

પુષ્ટિમાર્ગીય ઉદ્ઘોધ.

(લાગ્ન ૧ લો.)

અથ શ્રીગોવિદ્વનવાસી સાખી સહિતની
દીકા લખી છે.

(સાખી.)

ચદો સખી જાહો જાઇઓ જાહો અસે મનજરાજ,
ગોરસ એંચત હારિ મિલે એક પંથ હો કાજ.

(સાખી.)

રાગનદો પતિ ઝાનરો ધરતીદો પતિ ધીદ,
તારતનદો પતિ ચંદ્રમા ગોપિન પતિ ગોવિંદ.

(સાખી.)

અવની રવની શ્રીમંદુપુરી શ્રીધ્રમુને તાપર કેશ,
શ્રીગોવિદ્વન જાદો ભાલ હે તાડો તિલક શ્રીવિલુલેશ.

(સાખી.)

શ્યામ વરણુ શ્રીગિરિબધરણુ ગોપીજન ચિતચોર,
શ્રીમનજરાજ કુંવર જ્યામે અસે સો નાગર નંદકિશોર.

(साखी.)

अंकुर सम रस दृष्टि हो, दृसन मन अलिलाख,
पूरण लोक मन्मथ रटन सो कुंजलवन युगवास.

५

(चालू.)

श्रीगोवर्धनवासी सावरे लाल तुम गिन रखो न जय हो,
श्रीवल्लभ लडेते लाडिसे.

(साखी.)

अंकुर ऐन हसिंह कहो तीक वहन हिमाय,
नयनत आरति होय रही सो युग समान पल जय.

६

(चालू.)

अंकुर चिते मुसिडायडे लाल सुंदर वहन हिमाय.
लोचन तवपे भीन ल्यों लाल छिनु छिनु कल्प बिहाय हो.

(साखी.)

मुरली भंडुर अनवही सम सुरन कलधार,
चितमें यह धुनी युलि रही सो नागर नंदकिशार.

८

(चालू.)

सम स्वरन अंधानमें लाल भोडन वेणु अंगय,
मुरत मुङाई आधडे नेक भंडुरे भंडुरे गाय हो.

९०

(साखी.)

ओलत रस लरे ऐनही गिरि यहि दीनी १२,
बोरी धुमरि गांग युक्ताई टेरत वहन जेइर.

११

(चालू.)

रसिंह रसीली ओलतनी लाल गिरि यहि जैयां युक्ताय,
गांग युक्ताई धुमरि नेक उंची १२ मुनाय हो.

१२

(साखी.)

वं क सम रसे दृष्टि है दृसन मन अलिलाख,
पूरण लोक मन्मथ रटन सो कुंजलवन सुगवास. ५

(चाल.)

श्रीगोवर्धनवासी सांवरे लाल तुम गिन रही न जय है,
श्रीवल्लभ लडेते लाडिये.

(साखी.)

वं क ऐन उसिके कहे तीक वदन विभाय,
नयनत आरति होय रही सो सुग समान पल जाय. ७

(चाल.)

वं क चिते भुसिकायडे लाल सुरन वदन विभाय.
साचन तदपे भीन ज्यो लाल छिनु छिनु कह्य बिहाय है.

(साखी.)

मुरली भमुर भगवली सम सुरन कवद्योर,
चितमें यह धुनी युलि रही सो नागर नंदिशार. ८

(चाल.)

सम स्वरन अधानसो लाल मोहन वेणु अन्नय,
भुरत भुलाई आंधके नेक भमुरे भमुरे गाय है. ९०

(साखी.)

ओखत रस लरे ऐनही गिरि चढ़ि हीती टेर,
बोरी धूमरि गांग युक्ताधि टेरत वदन जेझेर. ९१

(चाल.)

रसिक रसीली ओखनी लाल गिरि चढ़ि जैयां युक्ताधि,
गांग युक्ताधि धूमरि नेक उंची टेर सुनाय है. ९२

(साखी.)

જ દિનતો હેઢે દ્રગન અડુચિ ભયો સંસાર,
તીંદ ન આવે રેત દિન સો ભૂલી આરાહાર. ૧૩

(ચાલ.)

દ્રષ્ટિ પરી જ દિવસતો લાલ તથતો રૂચે ન આત,
રજીતી તીંદ ન આવહી મેાહિ બિસર્ણો લોજન પાન હો. ૧૪

(સાખી.)

દર્શનકોં અભિયાં તપે લાલ અવણું તપે નિજ ઐન,
મિલવેકું હિંયરાં તપે જીથમે ખાડુત પ્રસન ૧૫

(ચાલ.)

દર્શનકોં નથના તપે લાલ અચન સુનનકોં કાન,
મિલવેકું હિંયરાં તપે મેરે જીથકે જીવન આણુ હો. ૧૬

(સાખી.)

ચાતક સ્વાતિ વિલાસ હેં કોચન નિમિષ થુંગું જથ,
હેઢોં દ્રષ્ટિન ચાહસોં સો સુંદર નટવરરાય. ૧૭

(ચાલ.)

મન અભિદ્યાખા હોય રહી લાલ લાગત નથન નિમેપ,
એક ટક દેખું ભાવતો ઘારો નાગર નટવર ભેખ હો. ૧૮

(સાખી.)

નિરખોં વદન જ્યોં શરદ શર્થી મન અટક્યો યાદી ઓાર,
અમૃત રસકે પાનકોં સો કુસુહિની ઓાર ચકોર. ૧૯

(ચાલ.)

પૂરણ શર્થી મુખ્ય હેણકું લાલ ચિત ચોટ્યો યાદી ઓાર
ઝીપ સુધારસ પાન હે લાલ સાદર ચંદ ચકોર. ૨૦

१०

(साखी.)

तल विवेक लग्जा तज्जन सज्जन कुड़ंब संसार,
शोभित रवीसे देखिएं सो प्रीति अधिक अपार. २१

(चाल.)

लोड़दान कुल वेद्धी लाल छांडयो सकव विवेक,
उमेश कली रवी नयो बढ़े सो क्षणु क्षणु प्रीति विशेष हो. २२

(साखी.)

झाटि काम अलिहारेहो निरभत गजगति चाल,
गजयुवतीनके नेहड़ों सो नयन कुमल विशाल. २३

(चाल.)

मनभय झाटिक वारण्णे लाल निरभी डगमगी चाल,
चुनती जन मन इंदना लाल अंधुर नयन विशाल. २४

(साखी.)

जार पैया चातडी रटत जखद नयो नेह,
नागर नंद किशोर घिन किन धाम आर गोह. २५

(चाल.)

यह दट लागी लाडिये लाल नेसों चातड मोह,
ग्रेम तीर अरभाधये पिय नववन नंदकिशोर. २६

(साखी.)

सखन कुंज नित भिवस हो यह सुभ अधिक अपार,
हम श्री वृद्धवन वेली लहौ तुम भद्रुप करो शुल्लर. २७

(चाल.)

कुन्जवन कीड़ा करो लाल सुभनीधी भद्रतगोपाल,
हम श्री वृद्धवन भालती तुम लोगी अमर लुपाल. २८

३२

(साखी.)

सदा सर्वदा युगनमें प्रभु राजो चरणे निवास,
हरिदास ब्रज पाहुनो सो दास चतुर्भुज पास. २४

(चालौ.)

युग युग अविश्व राजिये लाल यह सुभ शैव निवास,
श्रीगोवर्धनधर इपें खिलारी चतुर्भुजदास. ३०

(साखी.)

यह भेरी अलिलाख हें पूरी श्रीनंदुभार,
छणिपर ग्रटिक वारणे सो तन मन ग्राण आधार. ३१

(साखी.)

कहा कहुं रसना एक हें लहि न लक्ष किरोर,
क्षें करिकिं वरन हें सो दास सदा कर जेड. ३२

(साखी.)

अथतो छ्य अदुखात हें दरसन देहो पिथ मोहि,
जंचो तारी ग्रेमझी सो तथहीं भिजनो होय. ३३

(साखी.)

पंउरपुर हरि राजहीं व्ययन श्रीविष्वभ ठाथ,
श्रीगोदुखमें प्रकट लये नाम श्रीविष्वलनाथ. ३४

(साखी.)

शिर टोपी कटि काढनी अंग अषिर कटि ठाथ,
यह बानक भेरे मन व्यसो सदा श्री विष्वलनाथ. ३५

(साखी.)

थान श्रीविष्वलनाथडो सदा रहो भम चित्त,
हाडे राजत ईटें सो लेटत अपने भीत. ३६

संपूर्ण,

અદો સંપૂર્ણ જઈએ જઈએ અસે વજરાજ,
ગોરસ એંચત હરિ મિલે એક પંથ હો કાજ.

અર્થ:—એક વજલડત ખીજા વજલડતો પ્રતિ કહે છે ને
આપણુને ગોરસ વેચવા જરૂર છે મારે જ્યાં વજના રાજ એવા પ્રભુ
વસે છે ત્યાં નૈયે તો ગોરસ પણ વેચાશે અને પ્રભુ પણ મળશે.
પંથ તો એકજ થાશે અને કાર્ય એ થાશે. શ્રીમહાપ્રભુજીએ પ્રકટ
કરેલા લક્ષિતવર્ધીની અંથમાં પ્રભુની સેવા એ પ્રકારથી કરવાની આશા
આપણીએ કરી છે. તેમાં પહેલી અવ્યાવૃત્ત પક્ષની સેવા તે ઉત્તમ
પ્રકારની. તે તો ક્રાઈ વિરલાથીજ બની રહે અને બીજી વ્યાવૃત્તિનું
તે પણ કેવી રીતે કુચિત કરતાં પણ ચિત્ત પ્રભુમાં રહ્યું આવે
તેવા પ્રકારની વ્યાવૃત્તિ કરવી. તો ગોપીજનની એ રીતી પ્રથમથી છે
ને ગોરસ વેચવાની વ્યાવૃત્તિ કરતાં પણ ચિત્ત પ્રભુમાં રહ્યું આવતું
તેથી કહ્યું ને વજના રાજ એવા પ્રભુ. વસે છે ત્યાં ગોરસ વેચવા
નૈયે તા. સેવાની રીતી અને પ્રભુને વિષે પ્રીતી ગોપીજનોનીજ આ
પુષ્ટિલક્ષ્મિ માંગને વિષે શ્રીમહાપ્રભુજીએ પ્રકટ કરી છે તે વિષે કહેવ
છે કુ (સેવા રીતી પ્રીતી વજનાનકી જનહિત જગ પ્રકારી) ગોપીજનો
વ્યાવૃત્તિ કરતાં પણ ચિત્ત પ્રભુમાં રહ્યું આવતું તેનો પુરાવી
ઉપકી સાખીમાં છે તે ઉપરથી શરણસ્થ હુંઓએ પણ પ્રભુમાં ચિત્ત
રહ્યું આવે તેવા પ્રકારની વ્યાવૃત્તિ કરવી.

(સાખી.)

રાગનકો પતિ કાનરો ધરતીકો પતિ દુંડ,
તારાનકો પતિ ચંદ્રમા ગોપીપતિ ગોવિંદ. ૨
અર્થ:—અધ્યા ભલીને રાગ છ છે. અનુકૂળ રાગની પાંચ પાંચ
શાગણીઓ, આહ આહ મુંગો, આહ આહ મુત્ર વધુઓ એ રીતે રાગનો

પરિવાર છે. તેમાં કાનરો રાગ શ્રી સ્થામીનીયને અહુ પ્રિય છે. તેમના મુખ્યી ગવાયેક છે તેથી અને એકાનરા રાગમાંથી વાગેશ્વરી, સથાતો, રાયસો, નાયકી, અહાણો, મુહી, દરારારી દ્રાશી એ અંધા રાગોની ઉત્પત્તિ થઈ છે તેથી કાનરા રાગને રાગોનો પતી કલ્યાણ. વળી બીજો પણું એ અર્થ થાય છે ને તમામ રાગોની ઉત્પત્તિ પ્રભુથી થઈ છે અને કાનર એવું પ્રભુનું નામ છે તેથી પોતેજ એ રાગોના પતી છે એવું પણ સ્ફુરણ થાય છે. ધર્તીનો પતી છું કલ્યાણ કારણું કે જી વૃષ્ટિ કરીને પૂર્વિને રસવાળી કરે છે, તેથી ઈદને ધર્તીનો પતી કલ્યાણ આને આકારામાં તારાગણું છે તેનો પતી અંદરમાં છે અને ગોપીજનનાં પતી ગોવિંદ છે.

(સાખી.)

અવની રવની શ્રીમદ્ધુપુરી શ્રી યમુનેતાપર દેશ,

શ્રીગોવર્ધન જાડો ભાલ હે, તાડો તિલક શ્રીવિહુસેશ. ૩

અર્થ:—પૂર્ણી માથે અભૂરોનો ભાર વણો થયો તે ન્યારે પૂર્ણી સહી ન શકો ત્યારે ગાયત્રું સ્વરૂપ ધારણું કરી પૂર્ણી દેવતાઓ પાસે જઈ એણે પોતાના હુઃખનો પોકાર કર્યો ત્યારે દેવતાઓએ કલ્યાણ ને એ તાં હુઃખ પ્રભુ વિના ક્રાદ્ધથી હુર નહિ થઈ શકું ત્યારે પૂર્ણી દેવતાઓને સાચે લઈ ક્ષીર સાગરને કરે જઈ પ્રભુની આગળ પોતાનું હુઃખ વિહિત કરી તેમાંથી રક્ષણું કરવા વીનંતી કરી ત્યારે વ્યુહાત્મક પ્રભુએ આકારાવાળી દારા આગાં કરી કે અમે અવતાર ધારણું કરી તારા એ હુઃખને દૂર કરશું. તે આગાંને અતુસાર વ્યુહાત્મક પ્રભુ મન્દુરામાં વસુદેવ દેવકીને લ્યાં કારાથકમાં પ્રકટ થયા તેથી. મનુરા કૃતાં મધુપુરીની ભૂમી રમણીક કષી તેમજ એ વજભૂમિ સ્વરૂપાત્મક પણ છે. શ્રીયમુનાજદને એ સ્વરૂપાત્મક પ્રજલ્લભીમના કેશની ઉપમા આપો છે અને ગોવર્ધન પર્વત ઊહેતાં શ્રીગિરિગાજળને એ સ્વરૂપાત્મક

ગ્રંથ ભૂમિના લાકની ઉપમા આપી છે તો ભાવ સ્તું ન હોય નેથેએ,
ભાવ માથે તિકંક નેથેએ તો એ સ્વરૂપાત્મક વજભૂમીના તિકંકની
ઉપમા શ્રીવિકૃતનાથજી કેંઠાં શ્રીગુસાંધુંઘનેંઅપી છે કારણું કે વજભૂમી
શ્રીગિરિજાજી શ્રીયમુનાજી એ બધાના સ્વરૂપને અમણે જણાવ્યાં
તારેણ આપણે જણ્ણું શક્યા. નહિ તો ક્યાંથી જણું ? તેથી શ્રીગુસાં-
ધુંઘને એ સ્વરૂપાત્મક વજભૂમિના તિકંકની ઉપમા આપી છે. ખીજો
આર્થ એ છે ને શ્રીગુસાંધું સાદ્ધાર્ત પુર્ખ પુરુષોત્તમ હોવાથી એ
સ્વરૂપાત્મક વજભૂમિમા તિકંકદ્વારા આપજ છે માટે અમને તિકંકની
ઉપમા આપી છે તે યુદ્ધ છે.

(સાખી.)

સ્થામવરણું શ્રીગિરિવિરધરણું ગોપીજન ચિત્તચોર,
શ્રીવજરાજ કુંવરઘન્યમેં ખસેસો નાગર નંદકિશોર. ૪

અર્થઃ—ગીરી કેંઠાં પર્વતોમાં ચૈક એવા, શ્રીગોવર્ધન પર્વત
ધારણું કરવાવાળા હે શ્રીનાથજી આપણું શ્રીઅંગ શામળું છે અને
આપ શ્રીગોપીજનના ચિત્તને ચોરવાવાળા છો અને વજના રાજ
એવા નંદરાયના કુંવર છો, ને નાગર છો તેમાં નંદકિશોર છો તે
મારા હૃદયમાં વસો અમ આ ઝીર્તનનું ગાન કરનાર અષ્ટ સખામાં
ચતુર્ભુજદાસજી છે તેઓ કહે છે,

(સાખી.)

અંક સમ રસ દાઢિ હે દુરસન મન અલિકાખ,
પૂરણું દોડ મન્મથરટન સો કુંજ લખન યુગ વાસ, ૫
આ સાખી શ્રીગોવર્ધનવાસીના સાખી સિવાય ખાર ચરણ છે.
તેનાં સ્વરૂપને માટે કરેલો છે તે એવી રીતે કે એ સાખીમાં પ્રથમ
શાખ (અંક) છે તેણે કરીને શ્રીગોવર્ધન વાસીના પ્રથમ ચરણ (અંક

ચિતે મુસિકાયઙે લાલ સુંદર વહન દિખાય) એનું સૂચન કર્યું છે. બીજો
 શાખા (ભરમ) છે. તેણે કરીને બીજા ચરણ (સમ સ્વરન અંધાનસો લાલ)
 એનું સૂચન કર્યું છે. બીજો શાખા (રસ) છે. તેણે કરીને બીજા ચરણ
 (રસીક રસીલી જોકની લાલ) એનું સૂચન કર્યું છે. ચોથો શાખા (દષ્ટી)
 છે, તેણે કરીને ચોથા ચરણ (દષ્ટિ પરી ન દિવસેં તે લાલ) એનું
 સૂચન કર્યું છે. પાંચમો શાખા (દર્શન) છે, તેણે કરીને પાંચમા ચરણ
 (દર્શન કો નથના તપે લાલ) એનું સૂચન કર્યું છે. છઠો શાખા (મન
 અભિકાશ) છે. તેણે કરીને છઠો ચરણ (મન અભિકાશા હોય રહી)
 એનું સૂચન કર્યું છે. સાતમો શાખા (પુરણ) છે. તેણે કરીને સાતમા
 ચરણ (પુરણ શરીર સુખ દેખણે લાલ) એનું સૂચન કર્યું છે. આડમો
 શાખા (દોડ) છે તેણે કરીને આડમા ચરણ (દોડ લાજ કુલ વેદકી
 લાલ) એનું સૂચન કર્યું છે. નવમો શાખા (મનમથ) છે. તેણે કરીને
 નવમા ચરણ મનમથ કોટિક વારણે લાલ એનું સૂચન કર્યું છે. દશમો
 શાખા (રટન) છે. તેણે કરીને દશમા ચરણ (યહ રટ લાગી લાંબા લાંબા લાલ)
 એનું સૂચન કર્યું છે. અગ્નારમો શાખા (કુંજ લખન) છે તેણે કરીને
 એનું સૂચન કર્યું છે. આરમો શાખા (યુગ) છે. તેણે કરીને આરમા ચરણ (યુગયુગ અવિચલ
 રાખીએં લાલ) એનું સૂચન કર્યું છે. એવી રીતે આ સાખી શ્રીગોવિ-
 રાખીએં લાલ) એનું સૂચન કર્યું છે. એવા શ્રીનાથજી આપના દર્શનની મનમાં
 પ્રકારના રસથી સરેલી છે એવા શ્રીનાથજી આપના દર્શનની મનમાં
 ધ્રુવી અલિકાશા છે અને પુર્ણ કેતાં અથા મળાને ૧૪ દોડ છે. સાત
 દુષ્કૃષ્ણ દોડ, સાત અધો દોડનો આપ મનમથ કેતાં અદૌડિક કામહેવ
 રૂપ છે, તેથી રટન કરવા ચોથ્ય છો અને યુગ કેતાં યુગદ્ય સ્વરૂપ
 શ્વામિનીજી સાહેત આપનું વસ્તુ કુંજલખનને વિષે છે.

(ચાલ.)

શ્રીગોવર્ધન વાસી સાંકેતિક તુમ જિન રહ્યો ન જાય છે,

શ્રીવજ્રાજ લડેતે લાદિયે।

અર્થ:—આ શ્રીગોવર્ધનવાસી અંષ્ટ સખામાં ચતુર્ભૂજદાસની ગાયેલી છે. તેઓ કહે છે જે હેં શ્રી ગિરિગોવર્ધનને વિષે વસ્તવાવાળા સાંકરા એવા શ્રીનાથજી અથવા નરના મુજા એવા નંદરાયજીએ લાડ લડાયકા એવા પ્રભુ તમારા વિતા હવે ભાગથી નથી રહેવાતું.

આ ગોવર્ધનવાસી શ્રીનાથજી જ્યારે ભયુરામાં સત્તબરામાં શ્રી ગુસાંધજીને ઘેર પદ્મારી લગભગ પોણું ત્રણ માસ ત્યાં અશોઝ્યા. મહા વદ ૭ થી તે વૈશાખ મુખ ૧૪ સુંદી દૃચિંહ ચતુર્ભૂજને દ્વિસે પાછા શ્રીગિરિજાજ પવાર્થી છે. પણ જ્યારે પ્રભુ ભયુરામાં બિરાજયા હતા ત્યારે શ્રી ગીરીરાજ હિપર આપના ચતુર્ભૂજદાસજીએ ગાઈ છે.

(સાખી.)

અંક જેન હસિકે' કહો નીકંબડન દિખાય,

નયનન આરતી હૈય રહી સૌ યુગ સમાન પદ જાય.

અર્થ:—ચતુર્ભૂજ દાસજી કહે છે જે હે શ્રીનાથજી, તમાં મુખચંદ સારી રીતે દેખાડીને હભિને વાંકા વચન કહો અને હે પ્રભુ આપના દર્શનને માટે નેત્રોની આરતી થઈ રહી છે. દર્શન વિતાની એક પદ જાય છે તે થુગ સમાન લાગે છે. આ સાખીમાં વાંકા વચન કહેવાની ભાગણી ચતુર્ભૂજદાસજીએ શા માટે કેરી છે કે વાંકા પણ છે તે અતિ રૂસને વંબાસવાળાણું છે તે વિષે રાસ પંચાધ્યાસીમાં કહેલેલ છે:—

નાગર નગાંધર નંદ ચંદ હસે મંદ મંદ તથ,

એંદ્રે આંકે જેન ગ્રેમકે પરમ એન સાં.

ઉજવલ રસદો યહ સ્વભાવ, વાંકી છાવી પાવે,
વાંક કહુન અરુ ચહુન વાંક અતિ રસ હી થાવે. ८७

જેસે સુંદર નાયક રૂપ ગુણ રસિક મહા હે,
સખ ગુણ મિથ્યા હોય નેક ને વાંક ન ચાહે. ८८

રાસ પંચાધ્યાયીના ઉપર લખ્યા ત્રણ ચરણનો અર્થઃ—હે
નાગર અને નગ કેતાં પર્વત કીયો કે શ્રી ગોવર્ધન પર્વત તેને
ધારણ કરવા વાળા શ્રીનિંદ્રાયજીના ચંદ્રમા રૂપ પ્રભુ તે વખતે મંદ
મંદ મુસકાધને પ્રેમથી પરિપૂર્ણ ભરેલા એવા વાંકા વચન જોયા
કારણું કે ઉજવલ રસનો એવા સ્વભાવ છે કે તેમાં નો વાંકાપણું
હોય તોજ ઉજવલ રસ દીપે તે કેવી રીતે કે વાંક કહેવું, વાંક ચાહેવું
વાંકાપણું છે તે અતિ રસને વધારવાવાળું છે. એક સુંદર નાયક હોય
તે રૂપે કરીને પરિપૂર્ણ હોય તેમજ ગુણે કરીને પણ પરિપૂર્ણ હોય પણ
તેમાં ને વાંકાપણું નહોય તો તેના સર્વ ગુણ મિથ્યા થઈ જાય તો
વાંકા વચન આવી રીતે રસથી ભરેલા હોય છે તેથીજ વાંક વચન
કહેવાની ચતુર્ભૂજદાસજીએ માગળી કરી છે.

(ચાલ.)

એક ચિતે મુસકાયદે લાલ સુંદર વદન દિખાય,
દોચન તથપે મીન જ્યો લાલ છિનુ છિનુ કલ્પભિહાય. ८९

અર્થઃ—હે શ્રીનાથજી, વાંકી ચિતવન એટલે વાંકી દશિથી
મારુ જોઈને અને મંદ મધુંદ મુસકાધને આપણું સુંદર એવું
વદન કેતાં મુખ્યચંદ હેખાડો. આપના દર્શનને માટે મારા નેત્રો (જરૂર
વિના જેમ માછળું તરફડે તેવી રીતે) તથપે છે આપના દર્શન
વિતાની દરેક ક્ષણ જાય છે તે કલ્પ (એ ઉજર ચર્ચાયગ) સમાન
જાય છે.

(साखी.)

मुरली भद्रुर अज्जवलीं सप्त स्वरेन कुञ्ज व्यार,
चितभें धृदधुती चुक्कि रही सो नागर नंदकिशोर, ८
अथर्वः—हे नागर, हे नंदकिशोर, तभो मधुर धनीथी सप्त
स्वरेनां भोरली व्यार एतां उच्चा स्वरेथी वगाडो छो ते भोरलीनी
धनी अभारा चितभां झुचि रही छे.

(चाल.)

सप्त स्वरेन अंधानसों लाल भोडन वेष्टुं अन्नय,
मुरत मुहार्छ आंधें नेक मधुरे मधुरे गाय हो. १०
अथर्वः—हे भोडन, सप्त स्वरेनां अंधारणु करीने तभो वेष्टुं ने
वगाडो अने सोल्लामणी आक्षापे करीने जरा मधुइं मधुइं गायो.

(साखी.)

ओक्षत रस उरे ऐनलीं गिरिचटि दीनी ११,
घोरी धूमरि गांग शुद्धार्छ टेरत वहन जे इर. १२
अथर्वः—हे प्रशु, आप ल्यारे ओक्षो छो त्यारे रस उरी
वाणीथी ओक्षो छो अने जोवर्धनं पर्वत भाथे चहीने गायो घोरी,
धूमरि, गांग ए अनी गायोने ओक्षावो छो त्यारे तमारी टेर सांसाग-
ताज गायो भोहुं इरवी तमारी सामु जुवे छे.

(चाल.)

रसिक रसीली ओक्षनी लाल गीरी चटि जैयां झुलाय,
गांग शुद्धार्छ धूमरि नेक उंची टेर सुनाय. १३
अथर्वः—हे रसिक प्रशु आपनुं ओक्षावुं रसीलुं एट्ये रस
उरेलुं छे तेथी श्रीगीरीजोवर्धनने भाथे चही गांग अने धूमरि गायने
उच्चा साहेथी ओक्षाववुं भने संलग्नावो.

૧૯

(સાખી.)

જ દિનતે હેણે દ્રગન અરુચિ ભયો સંસાર,
નીંદ ન આવે રેતદિન સો ભરી આર આહાર. ૧૩

અર્થ:—હે પ્રભુ, જે દિવસથી ગ્રાધ્યે કરીને તમને દીક્ષા તે
દિવસથી સંસાર વિષે અરુચિ થઈ અને તમારા વિના રાત ને દિવસ
નિદ્રા નથી આવતી તેમનું આહાર વિહાર પણ અહું ભૂખાઈગયું છે.

(ચાલ.)

દ્રષ્ટિ પરી જ દિવસતે લાલ તથતે ઇચ્છે ન આત,
રૂપની નીંદનું આવહી મોહિ અસર્થી બોજન પાત. ૧૪

અર્થ:—હે પ્રભુ જે દિવસથી તમો દ્રષ્ટિયે પડ્યા છો તે દિવસથી
માત્ર તમેજ ઇચ્છો છો. તમારા સિવાય બીજું કાંઈ ઇચ્છું નથી.
રાત્રિના નિદ્રા આવતી નથી અને ખાનપાત પણ વિસરી ગયું છે.

(સાખી.)

દર્શનકો નથના તપે લાલ અથણું તપે નિજ ધેન
હિથરા ભિલવેડું તપે છુયમે અહૃત પ્રસન્ત. ૧૫

અર્થ:—હે પ્રભુ, આપનાં દર્શન કરવાને ભાઈ મારા નેત્રો
તપે છે અને આપની વાણી સાંલળવાને ભાઈ મારા કાન તપે છે
અને આપને ભળવાનેં ભાઈ માઝે હૈયું તપે છે અને અથ પણ કેવળ
તમારે ભળવું તેમાંજ પ્રસન્તતા માને છે.

(ચાલ.)

દર્શનકો નેના તપે લાલ અથેન સુનતકોં કાન,
ભિલવેડું હિથરા તપે મેરે છુયકે છુવન પ્રાણ હો. ૧૬

અર્થ:—હે પ્રભુ, આપનાં દર્શન કરવાને ભાઈ મારા નેત્રો તપે
છે અને આપનાં મુખાર્દિની વાણી સાંલળવાને ભાઈ મારા કાન તપે

છે અને આપને ભળવાને માટે માં હૃદય તપે છે. કારણું કે મારા જીવના પણ તમે જીવન પ્રાણું છો.

(સાખી,)

ચાતક સ્વાતિ વિલાસ હેં લોચન નિમિષ સુગ જથ,
હેંબો દ્રષ્ટિન ચાહસો સુંદર નટવર રાથ. ૧૭

અર્થ:—ચાતક પક્ષી છે, તે પૃથ્વી માથે અનેક નિર્મિણ જસુ છે તેવીજ રીતે મારા નેત્રાદ્ય ચાતક હેં નવધનદ્ય પ્રલુબ આપનીજ માત્ર ચાહના કરે છે. આપ સિવાય ખીજને ચાહતા નથી. ચાતક સ્વાતિના જેવો નેત્રાનો વિલાસ થઈ ગયો છે તેથી નેત્રાની એવી દ્વાથ થઈ છે કે તમારા દર્શન કરતામાં આંખની પાંપણ આડી આવે તેટલો સમય પણ સુગ જેવો લાગે છે. નેત્રાની ચાહના એવી છે કે નટવર રાથ એવા સુંદર પ્રલુબને દ્રષ્ટિ લરિ લરિને જોયા કરે.

(ચાલ,)

મન અલિક્ષાખા હોથ રહી લાલ લાગત નેન ; નિમેખ,
એકટક દેખું લાવતો ખારો નાગર નટવર લેખ હે. ૧૮

અર્થ:—હે પ્રલુબ મનમાં તમારા દર્શનની અલિક્ષાપા થઈ રહી છે તેથી એકટક એટલે પાંપણ પણ ન મીચાય તેમ આપના પધારવાની રાહ પણ ચતુર્ભુજ દાસ જોઈ રહ્યા છે. કારણું કે ભથુરામાં સતથરામાંથી નૃસિંહ ચતુર્દશને વિલસે પાણ શ્રીગિરિજન ઉપર મંદિરમાં પદ્માયો છે તેને આગદે દ્વિવસે ચતુર્ભુજદાસને ગાડ વિરહ થયો. તેથી સાંજના સમયમાં ગયોના મંધ્યમાં યક્ષદૈવજી સહિત પ્રસ્તુતે દર્શન દીધા છે અને કહ્યું છે કે આવતી કાલ પર્વત ઉપર જરૂર પદ્મારસું એમ શીર્ષમુખથી આસા કરી છે તેથી ચતુર્ભુજદાસ એકટક

અર્થ આપના પવારવાની રહે જોઈ રહ્યા છે અને આગલી સંજ્ઞે
દર્શન આપેલ નાગર નટવર લેખ સ્વરૂપનું રમરણ કર્યું છે.

(સાખી.)

નિરણો વદન ન્યો શરદ શરી મન અટક્યો યાડી ઓર,
અમૃત રસએ પાનણો સો કુમુહિતી ઓર ચકોર. ૧૬

અર્થ:—ચકોર નામનો પક્ષી નેમ ચંદ્રમાને જોઈ રહે છે તેમ
શરહના ચંદ્રમાં નેવા આપના મુખચંદ્ર નિરખવાને માંડે મન ચકોર
થઈને અટક્યું છે ચકોરનું મન ચંદ્રમામાં શા માટે અટકે છે કે તેમાં
રહેલા અમૃતનું પાન કરવાને માટે અટકે છે. તેવીજ રીતે માંડે મન
તમારા મુખચંદ્રમાં અટક્યું છે.

(ચાલ.)

પૂર્ણ શરી મુખ દેખકે લાલ ચિત્ત ચોટ્યો યાડી ઓર,
ઝપ સુધારસ પાન હે લાલ સાદર ચંદ ચકોર. ૨૦

અર્થ:—ચકોર પક્ષી અનન્ય વૃત્તથી ચંદ્રમા સામુ જોઈ રહે
છે, તો તેને ચંદ્રમા પણ આદર સહિત પોતામાં રહેલા અમૃતનું પાન
કરાવે છે; તેવીજ રીતે માંડે ચિત્ત ચકોર ઝપ છે તે આપના મુખાવિંદ-
ઝપ પુર્ણ ચંદ્રમામાં ચોટેલું છે તેથી આપના ઝપમાંદુરી ઝપ અમૃતનું
પાન મને કરાવો.

(સાખી.)

તથ વિવેદ કલાત્મ તજો સજન કુદુંઘ સંસાર,
શાલિત રવીસે દેખિકે સો પ્રીતી અધિક અપાર. ૨૧

અર્થ:—હે પ્રભુ, આપની શોભા રવી કેતાં સૂર્યના જ્યેણી
જોઈને આપમાં ગ્રાતી પાર વિનાની અધિકાધિક થાથ છે તેણે કરીને

સતજનોની તેમ કુંખીઓની અને સંસારી જગતોની લાજ છુટી જાય
છે તેમ તે સંખ્યા વિવેક પણ તરફ જાય છે.

(ચાલ.)

લોક લાજ કુદુરુ વેદભી લાલ છાંડ્યો સકલ વિવેક,
કમદકલી રવી જ્યોતિં અહે લાલ છિત્તિન પ્રીતિ વિશેષ હો. ૨૨

અર્થ:—હે પ્રભુ, આપને માટે લોકની અને કુળની લાજ અને
વેહની ભર્યાં અને સર્વ પ્રકારનું વિવેક એ અધું સુકાઈ ગયું છે અને
સૂર્યના ઉદ્ઘયી કુલની કલી નેમ નેમ ભીબતી આવે છે તેમ તેમ
તમારામાં ક્ષણુદ્ધણુને વિષે પ્રીતિ વખતી આવે છે.

કાટિ કામ અલિહાર હોં નિરખત ગજગતી ચાલ,
શજ યુવતીને નેહંડો નથન કમદ વિશાલ. ૨૩

અર્થ:—ચાલ હાથીની પરમ સુંદર હોય છે તો હે પ્રભુ તમારી
ચાલ હાથીના જોવી મલપતી જોઈને ક્ષાટાનકેટિ કામદેવ તમારા ઉપર
અલિહારી જાય છે અને સેહ નેત્ર દ્વારા થાય છે તો પ્રજયુવતી,
એવા જે ગોપીજનો તેમને સેહ ઉત્પન્ન કરવા તમારા નેત્રો કમદ
સરણા અને વિશાલ છે.

(ચાલ.)

મનમથ ક્રોટિક વારણે લાલ નિરખી ઉગમગી ચાલ,
યુવતિ જનમન ઇંદ્રના સો અંશુજ નયન વિશાલ. ૨૪

અર્થ:—તમારી ઉગમગી ચાલ જોઈને ક્ષાટાનકેટિ કામદેવ
વારણે જાય છે અને યુવતીજન કેતાં ગોપીજન તેઓનાં મન ઇંદ્રામાં
નાખવાને માટે તમારા નેત્રકમદ જેવા અને વિશાલ છે.

(સાખી.)

મોર પપૈયા ચાતકી રટત જલદ જોયોં ને ૨૫
નાગર નંદકિશોર ગિત કહિન ધામ ઓર ગેહ.

અથ્રુ:—મોર પપૈયા અને ચાતકી એ સર્વ જલદ કેતાં મેદ
ચાથવા ધનની રટના કર્યા કરે છે. કારણું તેઓનો ધનની સાથે રનેહ
છે, તેમજ મને હે પ્રભુ ! નવધનશ્રી આપનીજ માત્ર રટના રહે છે,
અને હે નાગર ! હે નંદકિશોર તમારા વિના ધામગઢ બાંધું કહણું લાગે
છે; એટલે ક્યાંય સોણતું નથી.

(ચાલ.)

થહ રટ લાગી લાહિલે લાલ જેસેં ચાતક મોર,
ગ્રેમ નીર ખરખાછ્યેં પ્રિય નવધન નંદકિશોર. ૨૬

અથ્રુ:—મોર અને ચાતકને જેમ ધનની રટના લાગી રહે છે
તેમજ મને હે નવધન પ્રભુ તમારીજ રટના લાગી રહી છે. મોર
અને ચાતકની અનન્ય રટના છે, તો તે પુરી પાડવા મેદ જરૂર છે,
છતાં જલ વરસી તેમની આશા પરિપૂર્ણ કરે છે, તેમજ મારી આશા
હે નવધન ! હે નંદકિશોર ગ્રેમડી જલ વરસાવીને તમો પરિપૂર્ણ કરો.

(સાખી.)

સધન કુંજ નિત શિલસહી થહ સુખ અધિક અપાર,
હુમ શ્રીવંદાવન વેલી લઈ હુમ મહુપ કરો શુંજાર. ૨૭

અથ્રુ:—હે પ્રભુ ! વૃંદાવનની સધન કુંજમાં તમારો વિદ્યાસ
નિત્ય છે અને તે સંબંધી સુખ અધિકાધિક છે. એટલે પાર
વિનાનો છે. વેલીઓમાં રહેણા પુષ્પોના મદરંદમાં લુણ્ય થઈને લમરો
તેને ભાગે શુંજારવ કરે છે. કારણું તે મદરંદનો અવરો લોગી છે,
તેવીજ રીતે અમે વૃંદાવનની વેલીઓ છીયે અને તમો અવરશ્રી છો,
માટે શુંજારવ કરો.

(ચાલ.)

કુંજલવન કીડા કરો લાલ સુખ તીવિ મહન ગોપાલ,
હમ. શ્રીવંદાવન માલતી હુમ ભોગી લવર ભૂપાલ છો. ૨૮
અર્થ:- હે પ્રભુ આપ વૃંદાવનની કુંજ લવન વિષે કીડા
કરો. કારણું મહન કહેતાં અવૈકિક કામરપ આપ ગોપાલ છો,
તેમજ સુખનીધ કેતાં સુખના સમુદ્રવત છો. મારે અમને સુખ આપો,
અમે શ્રી વૃંદાવનની માલતી છીયે તો માલતીમાં રહેલા મકરંહના.
ભોગી લવરના પણ તમો ભૂપ છો.

(સાખી.)

સદા સર્વીદા યુગનમેં પ્રભુ રાખો ચરણ નિવાસ,
હરિદાસ મ્રજ પાહુનો સો દાસ ચતુર્ભુજ પાસ. ૨૯
અર્થ:- આ સાખી ઉપરથી એમ જણાય છે ને શ્રી ગોવર્ધન-
વાસી તો ચતુર્ભુજ દાસળાએ ગાઈ છે. પણ તેની ને સાખીએ કરનાર
હરિદાસ નામના વૈષણવ હોવા જેઠાયે તેઓ કહે છે ને હે પ્રભુ!
સદાસર્વીદા યુગેયુગ પ્રતી મારો નિવાસ આપના ચરણુકમલમાં રાખજો.
હું હરિદાસ મ્રજનો પરોણો છું તેને ચતુર્ભુજ દાસની પાસે રાખજો.

(ચાલ.)

યુગ યુગ અવિચલ રાખીયે લાલ યહ સુખ શૈક્ષ નિવાસ,
શ્રી ગોવર્ધનધર ઇપ્યે બલિહારી ચતુર્ભુજ દાસ. ૩૦

અર્થ:- ચતુર્ભુજ દાસળ કહે છે ને હે પ્રભુ આપ સંભંધા
સુખની પ્રાપી મારે યુગેયુગ પ્રતી મારો નિવાસ શ્રી ગિરિજાજીને વિષે
રાખજો અને હે ગિરિજાજીને ધારણ કરવાવાળા શ્રીનાથજી તમારી
ઇપ માધુરી માથે હું બલિહારી જઈ છું: અથવા બીજો અર્થ એ
પણ થાય છે ને હે પ્રભુ! આપનો નિવાસ યુગેયુગ પ્રતિ શ્રી ગિરિ-
જાજીને વિષે અવિચળ રાખજો. એડાયે આપ સંભંધી સુખ ત્યાં ભરો.

(સાખી.)

યહ મેરી અલિકાભ હેં પુરે! શ્રી નંદકુમાર,

છણિપર કોટિકવારને સો તન મન પ્રાણુ આધાર. ૩૧

અર્થ:—ચતુર્ભૂજદાસળ કહે છે ઉપર કહી તે અધી મારી અલિકાભાઓ છે તે હે શ્રી નંદકુમાર તમો પરિપૂર્ણ કરો, તમારી છણિ કેતાં સુદર્શા માથે મારા તન, મન અને પ્રાણ પણ હું કોયાન એઠીવાર ન્યોધાવર કરે છું. કાગળુકે તમો! મારા પ્રાણઆધાર છો.

(સાખી.)

કહા કરું રસતા એક હેં લઈન લક્ષ્મિ કિરોર,

કૃસે કરિકં વરણીયેં સો દામુ સદા કર જોડ. ૩૨

અર્થ:—ચતુર્ભૂજદાસળ કહે છે કે હે પ્રલુબ! તમારા ગુણગણુનો

પાર નથી તેનું વર્ણન કરવાને જગ્ઘાઓ લાખો કરોડો જોઈયેં તો પણ પાર ન આવે તો મારી એકજ કુલ્લા છે, તેથી હું કેમ વર્ણન કરી શકું હું તો તમારો દાસાનુદાસ છું. તેથી સત્તા હાથ જોડીને રહું.

(સાખી.)

અથ તો જીથ અદુલાત હેં દર્શન હેઠો પિથ મોય,

એચો ડારી ગ્રેમની તથાં મિસ્ટો હોય. ૩૩

અર્થ:—ચતુર્ભૂજદાસળ કહે છે કે હે શ્રીનાથજ હવે તો જીથ

ખાલુ મૂંઝાય છે. મારે મને દર્શન આપો, અને ગ્રેમની ડારી એચો

એટસે આપનું મળવું થાય.

(સાખી.)

પંડપુર હરિરાજહીં અચન શ્રી વંદુલ હાથ,

શ્રી ગોદુલમેં પ્રકટ લયે નામ શ્રી વિદુલનાથ. ૩૪

અર્થ:—પ્રલુબ કુર્સાક કાર્ય ગોતે કરે છે, તે ખીજને નિભિત

અનાવીને કરે છે. જેમણે શ્રીમહ લાગવત પોતાની વાણી છે, તેની

નિશાની એ જે આખા શ્રી ભાગવતમાં ક્યાંય શ્રી રાધાયાતું નામ નથી છ્ટાં નિમિત વેદભ્યાસળને અનાવ્યા તેવીજ રીતે નવાખ્યાન શ્રી ગુસાં-ઈંગ્લી વાણી છે, તેની નિશાનો એ જે એમાં આખા પરિવારનું નામ છે, પણ શ્રી ગુસાંઈંગ્લી અને વહુજી શ્રી વિક્રિયાવહુજી અને શ્રી પદ્માવતી વહુજીએ અન્ને નામ નથી, એથી તેમની વાણીની ખાત્રી થાય છે, છ્ટાં નિમિત ગોપાલદાસળને અનાવ્યાં. ગોપાલદાસના હૃદયમાં બિરાળ પોતેજ ગાયા છે, તેવી રીતે એવે પણ અન્યું છે. શ્રી નાથજીએ પાન્ડુરંગ શ્રી વિક્રિયાનાથજીનાં હૃદયમાં બિરાળ શ્રી મહાપ્રભુજી પાસેથી વચ્ચન માગી લીધું ને અમને તમારા પુત્રઙ્ચે અવતરવાની ઈચ્છા થઈ છે. એ વચ્ચનને અનુસાર (તે પુરુષોત્તમ પ્રકટશે શ્રીવિક્રિયાપ નિધાન, નેત્રકંમલે નાનાલાવે દેશે ભક્તાને સન્માન.) એટલે ઉપદા વચ્ચનને અનુસાર શ્રી વિક્રિયાનાથજી એટલે શ્રીગુસાંઈંગ્લી પ્રકટ થઈ નેત્રકંમલે કરીને અને વિવિધ પ્રકારુના ભાવે કરીને ભક્તજનોના સન્માન કર્યો અને એ શ્રી ગુસાંઈંગ્લી શ્રી ગોકુલમાં વિશેષ બિરાજયા છે.

(સાખી.)

વચ્ચન નિશે શ્રીનાથે માગ્યું કોધી શ્રીવિક્રિયાનાથજીનું વાત,
અમને તે ઈચ્છા એહ છે જે હું નંદન તમે તાત.

અથ્:—પાન્ડુરંગ શ્રીવિક્રિયાનાથજીનાં હૃદયમાં બિરાળને શ્રી નાથજી એજ શ્રી મહાપ્રભુજી પાસેથી વચ્ચન માગી લીધું ને અમને તમારા પુત્રઙ્ચે અવતરવાની ઈચ્છા થઈ છે. એ વચ્ચનને અનુસાર (તે પુરુષોત્તમ પ્રકટશે શ્રીવિક્રિયાપ નિધાન, નેત્રકંમલે નાનાલાવે દેશે ભક્તાને સન્માન.) એટલે ઉપદા વચ્ચનને અનુસાર શ્રી વિક્રિયાનાથજી એટલે શ્રીગુસાંઈંગ્લી પ્રકટ થઈ નેત્રકંમલે કરીને અને વિવિધ પ્રકારુના ભાવે કરીને ભક્તજનોના સન્માન કર્યો અને એ શ્રી ગુસાંઈંગ્લી શ્રી ગોકુલમાં વિશેષ બિરાજયા છે.

(સાખી.)

શિર ટોપી કટિ કાઠની અંગ અગિર કટિ હાથ,
થાક આનક મેરે મન અસો સફા શ્રી વિક્રિયાનાથ. ૩૫

અર્થ:—શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાંધજી અન્ને સાક્ષાત્ પુર્ણ—
પુરુષોત્તમ છે, તેની નિશાલી ઓળે જે વખતે શ્રી મહાપ્રભુજીનું પ્રાદુર્ભાવ
અભિકુંડમાંથી થયું તેજ હિંસે, તેજ સમયે શ્રીગિરિજાજી ઉપર
શ્રી નાથજીના મુખાવિનની ઝાંખી થઈ, આપ પોતે ભગવહના મુખ
સ્વરૂપ છે, અને લ્યારે શ્રી ગુસાંધજીનું પ્રાદુર્ભાવ થયું તેજ વખતે
શ્રીવિકુલનાથજી ઢાકુર ને હાકમાં શ્રી નાથકારામાં પિરાજે છે, એટા
ગાહીનું સેવ્ય સ્વરૂપ તે તેજ સમયે એક વેરાગી આવીને શ્રી મહા-
પ્રભુજીને સોંપી ગયો તો શ્રી મહાપ્રભુજી અને શ્રી યુસાંધજી અન્ને
સ્વરૂપનું પદ્માચનું સેવ્ય અને સેવક લાવથી ભૂતું ભાગે થયું છે, તેમાં
સેવ્ય સ્વરૂપથી પદ્મારેણ શ્રી વિકુલનાથજીનું શંગાર શ્રીમદ્દાદને વિષે
દ્વાપી કટિને વિષે કાઢતી અને આપનું શ્રીચંગ જૌર શ્યામ એટલે
અભિર વરણું છે અને આપના અન્ને શ્રીદસ્ત કટીને વિષે છે, એવા
હે શ્રી વિકુલનાથજી આપની શોભા મારા મનમાં વમો એમ અતુર્ભા-
દાસજી ફંહે છે.

(સાખી.)

ધ્યાન શ્રી વિકુલનાથજી સહી રહો મમ ચિત,
ઢાડો રાજત ધૂરપેં સો લેટત અપને મીત.

અર્થ:—અતુર્ભાદરાસજી કહે છે જે ઉપર વર્ણિત કરેલા સેવ્ય
સેવક લાવથી પ્રકૃત થયેલ અન્ને શ્રી વિકુલનાથજીનું ધ્યાન સદાસર્વાદ
મારા ચિતમાં રહો, પણ સેવક લાવથી પ્રકૃત થયેલ શ્રી વિકુલનાથજીના
પ્રાદુર્ભાવના ઝારણું મારે પાન્કુરંગ શ્રી વિકુલનાથજીને નિમિત્ત અનાચા
છુ તે પાન્કુરંગ શ્રી વિકુલનાથજી તો પંડરભૂર્માં ધરી ભાગે પિરાજે છે,
નેચો શ્રી મહાપ્રભુજી ત્યાં પદ્મારતાં સામા આવીને અભ્યા લ્યારે શ્રી
મહાપ્રભુજીએ કહ્યું ને અમે ત્યાં પદ્મારતા હેતા, તમો સામાં પદ્મારવાનો।

અમ શા ભાઈ લીધો ત્યારે પાંડુરંગ શ્રી વિકુલનાથજીએ કહ્યું જે મિત્ર આવે ત્યારે તેને સામે જઈને મળાવું નોંધાયે. એમાં કાઈ અમે નવાઈ નથી કરી પણ એ મિત્રતાનો પથ પ્રકટ કર્યો છે એવી રીતે કહ્યું તે વિષેનો પુરાવો મૂળ પુરુષમાં શ્રી દ્વારિક્ષણ મહારાજાનીએ કહેલ છે જે (તથા તે પંડુરપુર જે સિધારે, શ્રી વિકુલનાથ મિત્રનંદ પધારે, ભીમસ્થી કે પાર મિલે જાય હોડી તનમેં આનંદ અદ્યો તથ; અદ્યો આનંદ કરી ધીનતિ આપકું યહ અમ કલ્યો કહી શ્રી વિકુલનાથજીને મિત્રતા પથ પ્રકટાયો.) એ વાક્યોને અનુસાર પાંડુરંગ શ્રી વિકુલનાથજી મહાપ્રભુજી ત્યારે પંડુરપુર પધાર્યા ત્યારે તેમને સામા આવીને મળ્યા છે, તથી ઉપર્યોગ સાખીમાં કહ્યું જે (જેણું અપને મીત) એટલે મિત્રને મળ્યા.

અથ છિલગણું કિર્તન.

રાગ—રામકલી.

મન મૃગ વેદયો મોહન નથનન ખાનસોં ॥
ગુઢ લાવકી સેન અચાનક,
તકી તાન્યો ભુકુટી કમાનસોં. ૧

પ્રથમ નાદ બદ વેર નિકટ લૈ,
મોરકી સ્વર સત્ક અંધાનસોં ॥
પાછે અંક ચિતે મૃહ હાસિકે,
ઘાત કરી ઉલટી સુધાનસોં. ૨

અતુક્ષુજહાસ પીર યહે તનકી,
મિઠત ન ઓષધ આનસોં॥
હોય હેં સુખ તખહી ઉર અંતર,
આદિંગન ગિરિધર ન સુભનસોં.

૩

(મન મૃગ વેધ્યો મોહન નથતન આનસોં.)

શાખાર્થ:-—મન રૂપી મૃગને જેણું નામ મોહન છે એવા પ્રભુએ નેત્ર કટાક્ષ રૂપી બાળથી વેધ કરી નાખ્યો.

કીર્તિ—આ કીર્તિનાં શરૂઆતમાં મનને મૃગની ઉપના આપી છે તેમાં તો હઠ કરી છે. પ્રથમ રાણ (મન) છે તો મનનું લૈાડિક ધર્મ શું છે જે અનેક કોકણે લટક્યા કરવું. તે એરસો તો સંજાડ છે કે, ક્ષાટિ ઉપાય કરેથી મનનું લટકવું મરતું નથી અને લટકવા પણ ઇપ મનનો લૈાડિક ધર્મ ન્યારે નિવૃત થાય ત્યારે અદૈાડિક ધર્મ મનને વિષે આવે તે વિષે આશ્રયના એક કીર્તિનમાં કહેલ છે જે (લોકવૈદિકત્યાગ શરણગોપીશક્તિ) અર્થ લૈાડિક વૈદિક ઇળની આશા ન્યારે નિવૃત થાય ત્યારે ગોપીજનના ઠંશ એવા પ્રભુની શરણ સિદ્ધ થાય ત્યારે મન સર્વમાંથી નિવૃત થઈ પ્રભુમાં લગે એ મનનો અદૈાડિક ધર્મ છે. મનનું લટકવું અસ્કૃતી મન સ્થીર થયા વિના લૈાડિકમાં કરો વ્યવહાર ચારી શકતો નથી. ગમે તેવું લૈાડિક કાર્ય પણ જે સ્થીર મનથી કર્યા તો જ તે પરિપૂર્ણ થાસે. અસ્થિર મનથી કર્યા કરી પુરું થવાનું નથી અનુદે રહેવાનું તો મનનું લટક્યા લૈાડિકમાં પણ ન્યારે આસ્કુલું બધે પ્રતિઅંધ ઇપ છે તો અદૈાડિકમાં કર્યા પ્રતિઅંધ ઇપ હોય તેમાં કાંઈ નવાઈ જેણું નથી. હું મનના લટકવાપણ ઇપ લૈાડિક ધર્મ કરું મણે તે વિષે શિક્ષા

પત્રમાં શ્રીહરિશયળ આજા કરે છે કે મનને લગવલીકામાં લગવનોમનું
લગવદ કથામાં કે લગવદ સંબંધમાં જોડવાથીજ મનનું લટકવું
મટશે એ સિવાથ અન્ય રહેતાં બીજી કોઈ ઉપાય કરેથી પણ મનનું
લટકવું અટકવાનું નથી. મારો મન રિથર થઈ અન્ય સર્વ વિષ્યોમાં
થી નિવૃત્ત થઈ કેવળ પ્રક્ષુભાં લાગે એજ મનતી ઉત્તમ દ્રશ્ય એજ
માફદ્યતા વાથવા એજ મનતો એનોદિક ધર્મ છે.

હવે એ કોર્તાનમાં બીજો શાખા (મૃગ) છે તો મૃગનો લૈાકિક
ધર્મ શું છે કે આઢાર અને વિદ્ધાર. પણ મૃગનો ગાન અવણુભાં
ધાયી આસક્ત છે. જે કે ગાન અવણું એ પણ કાંઈ અદૌદિક
વિષ્ય નથી લૈાકિક વિષ્યજ છે છતાં તેમાં મૃગની આસક્તિ એટલી
અધી છે કે ગાન અવણું કરતી વખતે પોતાના આઢાર વિદ્ધાર રૂપ
લૈાકિક સુદ્રદ ધર્મોનું સમરણું પણ તેને રહેતું નથી. બધું વિસમૃણ થઈ
નાય છે એટલું નહીં પણ ગાન અવણું રૂપ લૈાકિક વિષ્યની આતર
પોતાના પ્રાણું પણ અર્પણું કરે છે. પ્રાણુની પણ દરકાર નથી કરતો
એ એના લૈાકિક સ્નેહની પણ ઉત્તમ દ્રશ્ય છે એજ તેની અતન્યતા
છે. એ વિષે સૂર્ય પચીસીમાં સૂરદાસળાએ રહેલ છે કે—

મુભર સ્નેહ કુરંગડો રે અવણુન રાચ્યો રાગ,

ધરી ન શક્યો પગ પણમનોરે સર સન્મુખ ઉંલાગ.

અર્થ—સૂરદાસળ રહે છે જે મૃગના જેવા સ્નેહથી પ્રક્ષુનું
સમરણ લજન કર એવી રીતે પોતાના મનને મંદ્રાધીને શરણસ્થ
ળોંગે પ્રતિ રહે છે. કારણ મૃગની ગાન અવણુભાં આશક્તિ હોવાથી
તેમાં તે રાચ્યેલો છે એટસે નિભગ્ન છે. ગાન અવણું કરતી વખતે
પારદી સન્મુખથી બાણું મારે છે તે એના ઉસ્થલભમાં ચૂંગી લાગે છે
છતાં મૃગ પાછું પગદું પણ ભરતો નથી ને પોતાના પ્રાણ સુધીં

અપ્રેણુ કરે છે તેથી સુરવાસળ કહે છે ને આવા પ્રકારનું સ્નેહ
પ્રભુમાં રાખવું તેમાં કદાચ મર્ણું પર્યતનું હુંખ આવી પડે તો તે
સહન કરવું પણ એવા અનન્ય પ્રભુ સ્નેહને ન છોડે તો કામ થાય
તે વિષે પંચામૃત ગ્રંથમાં કહેલ છે જેઃ—

ચાખ્યો ચાહે ગ્રેમ રસ રાખ્યો ચાહે શીશ,
દો બાતે ક્રેસ બને હરિ ક્રોં કરે ખદ્ધીસ.

અર્થઃ—પ્રભુ સંબંધી ગ્રેમ રસ ચાખવાની ચાહના વાળાએ
એ ગ્રેમ પ્રાપ્ત થવાની ખાતર પોતાનું ભાથું સુદ્ધાં જાતું હોથ તો પણ
તેની દરકાર ન કરવી. આટલે દરળને પ્રભુ ગ્રેમની ચાહનાવાણો અવ
થાય ત્યારે તેને પ્રભુ ગ્રેમ રસની ખદ્ધીસ કરે. પણ જે ગ્રેમ રસ
ચાખવાની અને ભાથું ચાખવાની બનતે ચાહનાએ ને અવ
કરે તો પછી હરિ ગ્રેમ રસની ખદ્ધીસ કેમ કરે? એટલે નજ કરે.
વળો ખીને ડીર્ઠન (ચલો સખી મજ પેંડ લગી હેં જદાં બિકાત
હરિ ગ્રેમ) એ ડિર્ઠનાં અંતરમાં કહેલ છે કે (ચુડ સોંગો પ્રાણુનાં
પદટે ઉલ્લટ ધરો યહ નેમ) અર્થ—એ પ્રભુ સંબંધી ગ્રેમને માટે
દ્રાઘિક નહિ એસલું હોવાથી તમામ સસતો એમ કહું પણ
પાઠળથી કહું છે ને એ પ્રભુ સંબંધી ગ્રેમની ખાતર પ્રાણું સુદ્ધાં
અપ્રેણુ કરો તોજ એ ગ્રેમ મળે. તે સિવાય ન મળે. તો આવા
પ્રકારથી અનન્ય સ્નેહવાળું મન સ્થીર થઈ અન્ય સર્વ વિષયોમાંથી
નિવૃત્ત થઈ પ્રભુમાં લાગે ત્યારેજ તેવા પ્રકારના મનમાં મૃગનો ધર્મ
આવ્યા કરી ગણી શકાય તેવી દ્વારાને પહોંચેલા મનતે મૃગની ઉપમા
આપી શકાય તો ગોપીજનનું મન તેવી ઉત્તમોત્તમ સ્થીતીને પહોંચેલું
હતું. તેથીજ તેમના મનતે ચલુલું જવાસળાએ આ હેકાણે મૃગની
ઉપમા આપી છે પણ નેઓના મનમાં મૃગના નેવા ધર્મ ન આવ્યા
હોય તેઓના મનતે મૃગની ઉપમાજ ન આપી શકાય.

શ્રીજો શાખદ (વેધયો) છે, તો એ વેધ પણ અતિ ઉત્તમ પ્રકારનો.
 મહાનું અદ્વૈતિક છે ક્લાડિક વેધ તો આણું નાશક છે તેમ પીડા કરનાર
 છે. તેમ વેધ ધાત ઇથી હોવાથી ક્લાડિક વેધવાળાની ગતિ પણ ઉત્તમ
 ન થાય. પણ અદ્વૈતિક વેધમાં તો આણની હાની મુદ્દા ન થાય તેમ
 પીડા પણ ન થાય. આપણુંને ખાર એ ન પડે તેમ વેધ થઈ જાય
 તેમ અદ્વૈતિક વેધવાળાની ગતિ પણ ઉત્તમોત્તમ પ્રકારની થાય એટાં
 ભગવદ્યરણું વિંદની પ્રામ્લી ઇથી ગતિ પણ કરી ન
 થાય તે વિષે નવરત્ન ગંધમાં શ્રીમહાપ્રસ્તુત આશા કરે છે કે:—

ચિત્તા કાઢપિ ન કાર્યાં નિવેદિતાત્મલિઃ કદાપિ,
 ભગવાનપિ પુષ્ટિશ્યો ન કરિષ્યતિ લૈલાકિદીં ચ ગતિમ.

અથ્રો:—જેણે પોતાના આત્મા સહિત્ત સર્વર્સ્વ પ્રસ્તુતે અર્પણું
 કરેલું છે એવા શરણસ્થ લુલે ક્લાડિક વૈદિક ચિંતા કોઈ કાળે પણ ન
 કરવી. કારણું કે ભગવાન એવા આપણા પ્રસ્તુત પુષ્ટિશ્ય છે તેથી શરણું
 આવેલા એવા શરણસ્થ લુલની ક્લાડિક ગતિ કોઈ વખત પણ નહિં
 કરે તો નેનો પ્રસ્તુતા નેત્ર કટાક્ષના આણથી વેધ થયો છે તેની
 ક્લાડિક ગતિ કુમ થાય? નંજ થાય પણ મહાન અદ્વૈતિક ગતિ તેની
 થાય એ કારણથી એ વેધ પણ ઉત્તમોત્તમ પ્રકારનો કલ્યો.

હુદે ચોયો શાખ (મોહન) છે. તો પ્રસ્તુતાં અનેક નામ છે તો
 તેમાંનું બીજું કોઈ પણ નામ ન કહેતાં એવે મોહન નામ કેમ કહ્યું
 છે એમ જાણવાની છયા થાય તો કહેવાનું કે આ કીર્તનની શરૂ
 આત્મા ભનને મૃગની ઉપમા આપી છે તેથી પહેલેથી તે છેવટ ચુંધી
 તમામ વર્ણન મૃગને અતુસરતુંજ આવવું જોઈએ. પ્રથમ પારધી
 મૃગને ગાન શ્રવણ કરાવે છે તે દ્વારા તેને મોહ પમાડી પડી તેનો
 વેધ કરે છે તેવીજ રીતે એવે પણ પ્રસ્તુતે પ્રભાસકને મોહિત કરી
 પડીજ તેનો વેધ કરો છે અને સર્વને મોહ ઉત્પન્ત કરનાર પ્રસ્તુતજ

છે તે કાર્યને સૂચવનાં (મોહન) એવું પ્રભુનું નામ છે. તે નામને અતુસરાં એ લક્ષણે મોહ પમાઉવા ઇપ કાર્ય પણ આપે અને કર્યું છે તે કારણથી પ્રભુના ષીજાં નામો અને ન કહેતાં (મોહન) એ નામનીજ યોજના અને કરેલી છે.

પાંચમો અને છુટો શાખા (નયનન ખાનસોં) છે. બાળુ વિના વેધ થાય નહી તો પારાધી જેમ લૌકિક બાણથી ભુગનો વેધ કરે છે, તેમ પ્રભુએ નેત્ર કટાક્ષ ઇપી અદ્દૈકિક બાણથી વેધ કરેલો છે.

દ્વાં એ કૃતાંતના પ્રથમ ચરણનું ઉત્તરાદ્ધ કહે છે:—

ગૂડ લાવણી સેન અચાનક તકી તાણો ભક્તિ કમાનસોં. (૧)

શાખાર્થ—ગુમ લાવણી સેન એટલે સમસ્યા અચાનક પધારીને કરી અને આંખની ભમર ઇપી કમાન તાણુને અને તકીને બાળુ માર્યું. આમાં ષીજને શાખા (લાવ) છે તો આપણા પ્રભુ લાવિકદેવ છે તેમ જાપીજનનો આ પુષ્ટિમાર્ગ પણ લાવાત્મક છે. તો લાવાત્મક માર્ગમાં તમામ લાવ સહિતજ હોવું જોઈએ. લાવ વિના સર્વ નકાસું છે તેથી લાવણી સમસ્યા કરી છે.

પહેલો શાખા (ગૂડ) છે તે ગૂડલાવ એટલે ગુમ સ્નેહનું સૂચન કરેલું છે, સ્નેહ કેતાં પ્રીતિ ગુમ રહેલી જોઈએ તે વિષે મારી દાન લીલામાં જાપીજનોએ પ્રભુને કહેલું છે છ (પ્રીતિ હીથેમે રાખીએ સોતો પ્રકટકિએ રસ જય.) અર્થ—પ્રીતિ હીયામાં ગુમ રાખવી પ્રકટ ન કરવી પ્રકટ કરવાથી રસ ચાલુ જય તેથી ગૂડ કેતાં ગુમ લાવણી સમસ્યા કરી છે.

નીંજો શાખા (સેન) છે સેન એટલે સમસ્યા કરવાનું કારણ એ કે અનેક વજાબકોના વચ્ચમાં નેતે પોતનો ગુમ લાવ જણાવવો હોય તેને સમસ્યાથી કહે તો તેજ જણી શકે ષીજને ન જાણું તેથી સમસ્યામાં કહેલું છે.

શ્રીશ્રી શાખદ (અચાનક) છે તો પ્રમુની એ રીતી છે કે જે લક્ષ્મને કંધું હોય કે આજે સાંજે તારે ત્યાં પધારસું તો તે અચારા આભી રાત્ર વાટ જેયા કરે પણ ત્યાં ન પવારે કારણું કે એ દારી તેમને વિશેષ આરતિ કરવે અને જેને કંઈ પણ ન કંધું હોય તેને લાં પોતાની ધર્મશાલી અચાનક એટલે ઓચિંતા પવારે તેવીજ રીતે આ લક્ષ્મન પણ કહે છે કે ભારી પાગે પણ એવી રીતે અચાનક પવારી મને સુસ્ત લાવની સમયા ડરી પણી ભરુંની એટસે આંખની સમર ઇપી ક્રમાન તાણીને અને તડીને બાણુ માર્યો.

હવે તક્કવાતું કારણું એ કે જેને બાણુ મારવો છે તેને તકીસે મારે તોજ તેને લાગે તેથી તકીને મારેલ છે. અને વળી તાણીને મારેલ છે તે એટલા માટે કે તાણીને મારે તોજ લાગે નહિંડાં ખાલી નથી તેથી તાણીને મારેલ છે.

હવે પારાધી ક્રીડિક ક્રમાન તાણીને બાણુ મારે છે તેમ પ્રશ્નું આંખ ઉપરની સમર ઇપી અલોકિક ક્રમાન તાણીને બાણુ મારેલ છે.

હવે એ કીર્તના ખીજ ચરણનું પુર્ણાર્થ કહે છે.

(પ્રથમ નાદ અદ ધેર નિકટ લે મુરલી સ્વર સમઝ અંધાનસોં)
અર્થ—પ્રથમ સત્ત સ્વરોના મોરલી નાદના અગે કરીને ધેરીને મને નિકટમાં કીધ્યા. હવે આ ડેકાણે (પ્રથમ) શાખદ કહેવાતું કારણું એ છે કે નેત્ર કયાકના બાણુથી વેધ કર્યાથી આગળની હક્કિકત હવે કહેવાતું શરૂ કરે છે તેથી અગે (પ્રથમ) શાખદ કણો છે તે પણી ખીજે અને ત્રીજે શાખદ (નાદ અદ) છે. તો પારાધી પ્રથમ ગાન અવણુ કરાવી તે નાદના બાગથી મુગને મોહિત કરી પોતાની નિકટમાં લે છે. તેવી રીતે પ્રમુને મોરલી નાદના અવથી ધેરીને મને નિકટમાં લીધ્યી. હવે લોકિક નાદમાં ઉઠ્યું અગ્ન સામર્થ્ય છે કે તેના અવથી

મૃગ એંચાઈને પારાધી પાસે આવે છે તો અંકોડિક મોરલી નાનમાં
એ દૈક્ષિક નાન કરતાં ડોડી ગણું અધિક સામર્થ્ય છે તેનું વર્ણન
રાસ પંચાધ્યામાં નંદદાસજીએ કરેલ છે કે જ્યારે પ્રભુએ અંકોડિક
મોરલીનો નાન કર્યો ત્યારે તે નાન શ્રવણના અભિન્યાસ (સિદ્ધા સંબિલ
હોય ચલી સીદા હોય રહી સંબિલ પુનિ) અર્થ—મોરલીનો અંકોડિક
નાન સંભળતાં સિદ્ધા હતી તે પીગળાને પાણી થઈ વહી ચાલી અને
પાણી હતું તે જામીને સિદ્ધા ઇપ થઈ ગયું, વળી એજ રાસ પંચા-
ધ્યામાં કરેલ છે કે (નગનકે ધર્મ ન રહે પુલક તન ચલે ઢોરતે
ખગ મૃગ ગેં વચ્છ મચ્છ તે રહે ઢોરતે) અર્થ—જ્યારે મોરલી નાન
થયો તે વખત શું થયું તે કહે છે ને પર્વતોનો દૈક્ષિક ધર્મ એ છે
કે કટણું થઈ એડજ ટેકાણે રહેતું પણું મોરલી નાન સંભળતાં તેમનાં
તન કેતાં અંગ પુલકિત એપણે શેમાંચ ધ્યાં તેથી તે પીગળી પાણી
થઈ એક ટેકાણીથી વહી બીજે ટેકાણે ચાલ્યાં અને ખગ કેતાં
આકાશમાં ઉડતાં પદ્ધતિઓ, મૃગ ગળું જાયો, વાણરાંઓ, માછાંઓ,
કાચાઓઓ એ અધારી આન પાનમાં એટલી પ્રીતિ છે કે આવતી
વસ્તુ પોતાના અચ્યાતા મોરલીમાં હસે તો તે લઈ એની મા આપું
જસે પણ જ્યારે પ્રભુએ મોરલીનાન કર્યો તે વખતે એઝો! એ ભાવાને
માટે મોરલીમાં નાખેલ ડોળીયા એમને એમ રહી ગયા. તો અંકોડિક
એવા પ્રભુના મોરલીનાનમાં એલણું અણું સામર્થ્ય છે તો તે નાનના
અભિન્યાસ, એ વજ લક્ષ્ય કહે છે કે, શેરીને મને નિકટમાં લીધી.

ચોથો શાખા (ધેર) છે એટદે વેરીને નિકટમાં લીધી, હવે
ધેરવાનું શું પ્રયોજન એમ શાંકા થાય તો જણુણાનું કે ધેરા નાખ-
વાયી તે તેની આગળથી આથે જાઈ નથી શકતો. ને આથે જન્ય
તો વેદ્ય થાય નહી તેથી મૂગને પારાધીએ ગાનશ્વણુંથી નાનના

અદ્યથી એંચાને નિકટમાં લીધો એટલુંજ નહીં પણ તે નાદ અને
મુગને એટદી અસર કરી કે તે આદ્યો જઈજ ન શકે. એટસે નાદ
અદ્યે તેને વેરી પણ લીધો તેવી રીતે આ વજલક્ષ્ણ કહે છે કે
પ્રભુએ મોરકીનાદ અદ્યથી મને નિકટમાં પણ લીધી અને વેરી પણ
લીધી તે એવી રીતેં કે મોરકીનાં સૌન્દર વગાડીને,

હવે અનીન ચરણનો ઉત્તરાર્થ કહે છે કે—

પાછે અંકચિત્તે સૃહુ હસિદે ધાત કરી ઉકદી ચુદાનસોં (૨)
અથ—નાદ અદ્યથી વેરીને નિકટમાં લીધો પણ વાંકી ચિત્તવનથી
અને મંદ મધુંદ હસિને ઉકદી રીતિથી ધાત કરી અંકચિત્તવન એટસે
આપણું વાંકી દ્રષ્ટિથી નિહાળવું અને મંદ મધુંદ હસણું એ એ
વાના ધાત રૂપ છે. તો એ અને પ્રકારથી મારી ધાત કરી પણ તે
ઉકદી રીતિથી ધાત કરી છે એટસે લૈાંકિક ધાતથી એ ધાત ઉકદા
પ્રકારની છે. તે એવી રીતે કે લૈાંકિત ધાત તો પ્રાણુનાશક છે અને
આ અલૈાંકિક ધાતમાં પ્રાણની હાતી સુદ્ધન થાય તથી કહ્યું જે
ધાત કરી પણ (ઉકદી ચુદાનસોં) એટસે લૈાંકિક ધાતથી ઉકદી
રીતિથી એ અલૈાંકિક ધાત કરી.

હવે ત્રીજ ચરણનો પુર્વાર્થ કહે છે કે—

(ચતુર્ભુજદાસ પીર થઈ તનકી, મિયત ન આખું આનસોં.)
અર્થ—ચતુર્ભુજદાસજી કહે છે જે પ્રભુના નેત્ર કદાકના આખુથી
જેનો વેધ થયો છે અને વાંકી ચિત્તવન અને મંદધાસ્યાવલોકનથી
જેની ધાત થઈ છે તેનું ચિત્ત પ્રભુમાં તન્મય થઈ જાય છે તેથી
પ્રભુના વિયોગમાં તેને અત્યંત પીડા થાય છે. કોઈપણ પીડા નિવૃત્ત
કરવી હોય તો આખુથી લેવી જોઈએ. ઔષધી લીધાથી પીડા ભરે તો

આ! પીડા નિવૃત્તિને મારે પણ ઔપધી ખાંધાથી એ પીડા મરી જશે
ઓમ દોષ કહેતો ત્યાં કહે છે ને એ પીડા બીજુ ઔપધીઓથી ભરે
તેમ નથી. એસે આ અદ્વૈાકિક પીડા છે તે બીજુ કેતાં ક્લાકિક
ઔપધીઓથી ભરે તેમ નથી. ત્યારે હુમ ભરે તે એ ચરણુની પાછળી
હુકમાં કહે છે.

(હોયહેં સુખ તખણી ઉર અંતર, આદ્વિગન ગિરિધરત
સુનન સોં.) અર્થ—એ વજલક્તા કહે છે કે ભને પ્રભુ વિશેણ
ભૂષણી પીડા છે તે આત કેતાં બીજુ ક્લાકિક ઔપધીથી નથી મટવાતી,
ત્યારે હેમ મટશે તે કહે છે ને પ્રભુના વિશેણની પીડા છે તે પ્રભુનો
મિદ્ધાપં થઈ ને તેઓને આદ્વિગન થાય તો (એ અદ્વૈાકિક ઔપધીથી)
ભરે અને ઉરને વિષ અંતરમાં પણ સુખ ત્યારેજ થાય.

(સંપુષ્ટી.)

રાજભોગનું શીર્તન.

(રાગ—સારંગ.)

એસી પ્રીતી કહું નહી દેખી ॥
યશોભતિ સુત શ્રીવિષ્ણુસુત જેસી,
શેષ ક્ષાહસ્ત સુખ જત ન દેખી. (૧)

આજા માંગ ચલે શ્રીગોકુલ,
દ્રિરદ્રિર જંક જરેખન ચેખી ॥
સુનિયત કથા જલદ ચાતકી,
કુમુદિની ચંદ ચકેર વિશેખી. (૨)

ધનકો કીયો ગુણે લુચ ભાવત,
કરત શ્રૂંગાર વિચિત્ર વિશેખી ॥
ગોવિંદ ગોવદ્ધનપે માંગત,
બિષુરો પડત લુન અધ્રી નિમેખી. (૩)

(એસી પ્રીતિ કહું નહીં હેખી) લક્ષ્મિ માર્ગ ઐ પ્રકારના છે.
એક તો મર્યાદા અને બીજો પુષ્ટિ. મર્યાદા લક્ષ્મિ માર્ગમાં જૈશ્વર્ય ભાવનું
અંગીકાર છે અને પુષ્ટિલક્ષ્મિનાં સ્નેહનું અંગીકાર કરેલું છે. સ્નેહ સારોપર
છે પરંતુ સંસાર વ્યવહાર સંઅંધી સ્નેહ તે લૈાકિક સ્નેહ કહેવાય છે.
તે ક્ષણીક છે. નાશવંત છે. તેમજ વિકારવાળો. અને સ્વાર્થને લાદ્ય છે
પણ મ્રદ્ધુ સંઅંધી ને સ્નેહ છે તે અદ્દૈલીક સ્નેહ કહેવાય છે. તે
વિષે હ્યારામલાઠાએ લક્ષ્મિ પોષણ અંથમાં કહેલ છે કે (ઇપ ગુણ
દૃષ્ટિ એ વણુ વાતા પ્રીતિ થવાના કહાવે પણ એ વણુ વિકાર રહિત
સહજ સ્નેહ તે શ્રી. કૃષ્ણને ભાવે.) પ્રથમ લૈાકિક સ્નેહનું વર્ણન કરે છે-
ને કોઝ વ્યવહારમાં કોઈનું સુંદર ઇપ જોઈ તેના માયે સ્નેહ ઉત્પન્ન થાય
અથવા કોઈ ગુણી હોય તો તેના ગુણુ જોઈને પણ તેનામાં પાવવનામાં
સ્નેહ ઉત્પન્ન થાય તેમજ કોઈ દ્રવ્યમાન હોય તો દ્રવ્યની - લાલચે તેનામાં
કેટકાડોને સ્નેહ ઉત્પન્ન થાય છે. માટે ઇપ, ગુણ, અને દ્રવ્ય એ
વણુ વાતા પ્રીતિ ઉત્પન્ન થવાનાં કારણું ઇપ છે. છતાં તેનાથી ઉત્પન્ન
થયેદો સ્નેહ લૈાકિક કહેવાય છે. કારણું કે તે સ્નેહ સ્વાર્થને લાદ્યનું છે.
તેથી તે વિકારવાળો સ્નેહ કહેવાય છે પણ એ વણુ વિકાર રહિતનો
કે શુદ્ધ સ્નેહ તે હરીને લાવે છે અને લૈાકિક સ્નેહ કેવો છે? ક્ષણુમાં
સ્નેહ હોય તો બીજુ ક્ષણુમાં ઉત્તરી જાય. તે વિષે લક્ષ્મતરી કહે છે જે:-

છિનુ ઉત્તરે છિનુદી એ સોહી પ્રેમ ન હોય;
નિસવાસર લીજ્યો રહે પ્રેમી કહ્યુયે સોય.

૩૬

અર્થ—એક ક્ષણુમાં સ્નેહ થઈ આવે અને બીજુ ક્ષણ તે
પાછો ઉત્તરી જલ એવા પ્રેમતે પ્રેમતી જણુનીમાંજ નથી ગઇયો પણ
પ્રેમ પ્રાપ્ત થયા પણી જાત ને દિવસ તેમાં લીન્યો રહે તેજ પ્રેમી
કહેવાય. વળી પંચામૃતમાં કહેક છે જે:—

લક્ષ્મિ ભાવ લાદો નદી આવત હી ગહેરાય;
સરિતા સોણી જનીયે જેણ માસ હહેરાય.

અર્થ—ભાડવા માસમાં વર્ષાકાશ હોવાથી જરૂર વરસે છે તેથી
કરી ખાલી પહેલી નદીઓમાં જરૂર આવતાંની સાથે તે નદીઓ જગથી
પરિપૂર્ણ ધેરાઈ જય છે તેમજ લક્ષ્મિભાવ પણ થતાની સાથે એકદમ
ধેરાઈ જય છે તેથી શું થયું. સરિતા કેતાં નદી તો તેને જણુની
જે જેણ માસમાં કડકડતા તડકા પડે તે વખતમાં પણ તેમાં જરૂર
રહ્યું આવે: ખાલી ન થઈ જય તોજ તેને શરીતા એટલે નદી જણુની.
તેવી જ રીતે લક્ષ્મિભાવ ધેરાઈને નષ્ટ થઈ જય એ શું કામનો?
પણ ચાય તેવું હુંઘ આવે તે સહન કરી કે પણ પ્રાપ્ત થયેલું લક્ષ્મિ
ભાવને ન છોડે તો તે લક્ષ્મિભાવ સાચો કહેવાય. હવે આ કોણું
સરિતા એટલે નદીની ઉપમાં એટલા માટે આપી છે કે સરીતાનો
પ્રવાહ સાગર ભણી નિર્બંર વલ્લા કરે તેમ આપણો પ્રેમતો પ્રવાહ
નિર્જર અદૈાકિ સાગર એવા પ્રશ્ન તરફ વલ્લા કરવું જોઈએ. તેથી જ
અને સરીતાનું દાખાંત આપેલું છે. તો દૈાકિક સ્નેહમાં અને અદૈાકિક
સ્નેહમાં આપદો તારતમ્ય છે. દૈાકિક સ્નેહ તો કોઈપણ કરી કેશે
પણ અદૈાકિક સ્નેહ થદો અહુ કરણું છે તે વિષે પંચામૃતમાં વ્યાસ
ખાવા કહે છે કે:—

નેહ નિલાવત ડિન હે સુર હું નિલાવત નાહી;
ચદ્દનો મોં તુરંગપે ચદ્દનો પાવડ માણી.

અશ્રી—અદ્વૈાકિક સ્નેહને દેવતાઓ પણ નભાવી નથી શકતો.
તે સ્નેહને નિભાવવે બધું કહેયું છે. તે આગળ કહે છે ને મણુના
ધ્યાન ઉપર એસીને અગ્રિ વચાંથી ચાલવું કરું કહેયું છે? તેથી
અદ્વૈાકિક સ્નેહને નભાવવું કહેયું છે.

વળી પંચામૃતમાં કહેલ છે કે—

જગ હુંદ્યો ક્રોધ ના મિશ્યો નિભે અંત કો પ્રીતિ;
દોષી ચાખ ઓર દામ કે કદા જને રસ રીતી.

વ્યાસ પાવા કહે છે કે આખા જગતમાં ઐજના કરણું તો
પણ છેવટ સુધી પ્રીતિને નિભાવે તેવો ક્રોધ નહિ ભજો. તેનું કારણ
કહે છે કે સંસારી જનો તો ચાખ અને દામના દોષી એટલે રૂમાર્થ
પણ હુંદ્યું હોય છે તેથી તેઓ પ્રલુસ સંઘધી અદ્વૈાકિક રસ ઇપ પ્રેમ
ને શું જણું શકે? એ અદ્વૈાકિક રસ ઇપ શુદ્ધ પ્રેમનું શ્રીગોપીજનોએ
અંગીકાર કરેલ છે. તો આપણા આ પુષ્ટિભક્તિ ભાર્ગભાં એજ સ્નેહનો
અંગીકાર કરેલ છે. તે વિષે કહેલ છે કે—

સેવા રીતી પ્રીતિ વજજનકી જન હિત જગ પ્રકાદ.

એટલે પ્રભુની સેવા કેવી રીતે કરવી કે જેવી રીતે
ગોપીજનોએ કરી તેજ રીતીથી અને પ્રભુમાં પ્રીતિ કેવી
રાખવી કે જેવી પ્રીતિ ગોપીજનોએ રાખી હતી તેવીજ રાખવી.
તિજજન કેતાં શરણે આવેલા શરણુસ્થ ગ્રવોને માટે ગોપીજનની
સેવાની રીતી અને તેમના જેવી પ્રીતિ જગતને વિષે શ્રી. મહાપ્રભુજાને
પ્રકટ કરી છે. એ ગોપીજનનો પ્રભુમાં ક્રેટલો સ્નેહ હતો તે વિષે
રામ પંચાધ્યામીમાં કહેલ છે કે (અનકે નથી નિમેપ ઓટ કેટિક).

યુગ જહી) અર્થ ગોપીજનનો પ્રભુમાં ક્વો સ્નેહ હતો કે પ્રભુનાં દૃશ્યન કરતાંમાં આંખની પાપણ આદી આવતી એટદો સમય પણ કૃષ્ણ યુગ જેવડો લાગતો, તો આવા પ્રકારના સર્વોત્તમ ગ્રેમનો પુષ્ટિ-ભક્તિ માર્ગમાં આંગીકાર છે તેથી આવો સ્નેહ પ્રભુમાં રાખી પ્રભુને નાના પ્રકારના લાડ લયાવવા. પણ પ્રભુની સેવા અને કથા રસને શું જાળી શકે ? એને તો ફેલળ પ્રભુજ જણી શકે. પ્રભુ સિવાય ક્રોધિ જાણુંનું નથી અને વિદ્ધુરેલા જીવને પાછા લીકામાં લાવવા પણ છે. તેથી તેઓ પ્રભુની સેવા અને ગુણ્યાનમાં જે પ્રવત્ત થાય તો જ પાછા લીકામાં પહોંચી શકે. તો તેમના ઉપર દ્યા લાખી પ્રભુયે મનમાં વિચાર્યુ તે પ્રથમ આખ્યાનમાં કહેલ છે કે (શ્રી પુરુષોત્તમે વિચાર્યુ હવે પ્રકાર શ્રી કરીયે મારી સેવા અને કથા રસ નિઃપવા તનુ ધરીયે) પ્રભુએ વિચાર્યુ જે વિદ્ધુરેલા જીવને પાછા લીકામાં આપ કરવાને મારી સેવા અને કથા રસનું નિઃપણ કરું પડશે. તેને માટે હેઠ ધારણ કરીયે. એવો જે વિચાર પ્રભુએ કર્યો (તેને હેતે આપોપે પ્રકટયા શ્રીવિદ્ધુભરાજકુમાર) એટદે એ ધર્માને અનુસાર શ્રીવિદ્ધુભરાજ ને શ્રીમહાપ્રભુજ તેના કુમાર શ્રીગુસાંધુજ પ્રગટયા છે. પ્રકટ થઈ શું કર્યું તે સાતમાં આખ્યાનની શરૂઆતમાં કહેલ છે જે (આપ સેવા કરી શીખવે શ્રીહરિ ભક્તિ પક્ષ વૈભવ સુદૃઢ કર્યો) અર્થ—એ શ્રીગુસાંધુજ પોતે હરિદિપ છે તેથી હરિ પોતે જ પોતાની સેવા કરીને શરણુસ્થ જીવને શીખવી છે અને તે દ્વારા પુષ્ટિ ભક્તિ ઇપ ગોપીજનના માર્ગને સુદૃઢ કર્યો છે. જે હારણે પ્રકટ થઈ પોતાની સેવા કરી ન અતાવી હોત તો શું પ્રભુની સેવાને શું જાણી શકત ? અને જણ્યા નિતા કરી શકત પણ નહીં આગે તો શરણુસ્થ જીવના હિત માટે આટદો બધો અમ. ક્ષીધો તે વિષે આખ્યાનમાં કહેલ છે કે (નિઃસા-

ધન જનહિત કરવા શ્રીનાથવિકુલ આવીયા) પુષ્ટીલક્ષ્મિ ભાગ્યજ
 નઃસાધન છે તેમાં શરણે આવેલા જીવ નિઃસાધન છે તેમનું હિત
 કરવાને માટે શ્રીવિકુલનાથજ પદ્માંદ્રા છે. પદ્મારીને સ્નેહ સહિત
 પ્રમુની સેવા આંદોલિની રીતે કરી એમ અતાવી આપણું અને દળ પણ
 અતાવી રહ્યા છે. સ્નેહથી પ્રભુની સેવા આજ હિત સુંદરી પણ જેવી
 શ્રી વૃદ્ધભક્તશ્રીનાથજાળી એણે કરે છે તેવી તો કથાંય થવાની
 નથી. જોપીજનનો આ પુષ્ટીલક્ષ્મિ ભાગ્યજ સ્નેહાત્મક છે તેથી પુષ્ટિમાં
 સર્વ કાર્ય સ્નેહ સંયુક્ત જ હોનાં જોઈએ. વિના સ્નેહની સેવા પ્રભુ
 અંગીકાર કરતા નથી તેથી ગુમાંધિએ પણ આવા પ્રકારનું સ્નેહ
 પ્રભુમાં રાખી પ્રભુની સેવા સ્નેહ સંયુક્ત આપણને કરી અતાવીને
 શરીરવી છે તો એવી રીતે શ્રીગુસાંધજિ શ્રીનાથજની સેવા કરતાંમાં
 શ્રીનાથજમાં શ્રીગુસાંધજનો સ્નેહ કેવો હતો તેનું વિશેચન નીચે સુધ્રમાં
 શ્રીમહાપ્રભુજિએ પદ્મારે ભાગે એકેકમાં સ્થીર નિવાસ કરેલો છે
 તેમ શ્રીગુસાંધજિએ શ્રીગોડુકમાં નિવાસ કરેલો છે. તેમના સેવ્ય સ્વરૂપ
 શ્રીનવનીતપ્રીયાજ શ્રીગોડુકમાં મિરાજતા અને શ્રીનાથજ શ્રીગીરી-
 રાજજમાં મિરાજતા એવી રીતે જુદા જુદા કેઢાણે મિરાજવાનું કારણ
 એક ન્યારે આપશ્રી ગોડુક હોય ત્યારે શ્રીનાથજ સંબંધી આરતી
 થાતી અને શ્રીગીરીરાજજમાં હોય ત્યારે શ્રીનવનીતપ્રીયાજ સંબંધી
 આરતી થાતી તો જીવને પ્રભુ સંબંધી આર્તિ હંમેશા રહેવી જોઈએ એ
 સૂચયદ્વારા. એવી ઉત્કૃષ્ટ આરતીને દીવે એકાદ દ્વિવસને અંતરે શ્રીગોડુકની શ્રી
 ગિરરાજ અને શ્રી ગીરીશજથી શ્રી ગોડુક આપ પદ્મારતા એવા
 સમયમાં આપને શ્રીનાથજનો એકાદ દ્વિવસનો વરસહ તે યુગ જેવડો
 થાગતો તે વિષે આખ્યાનમાં કહેક છે કે (દ્વિવસ એકાદનો વિરહ તે
 યુગ સમેં નિરાંજન મિષે ઇપ હૃદ્ય ધરવા) આવા પ્રકારની પ્રીતિ
 શ્રીગુસાંધજની શ્રીનાથજમાં હતી તેથી કહ્યું જે:—

એસી પ્રીતી કહું નહીં દેખો.

અર્થ:—એવી પ્રીતી ક્યાંય દીડી નથી એમ અષ્ટસખાંમાં ગોવિંદહસળ વર્ણન કરે છે. હવે આ ડેકાણે એક શાંકા થાય છે કે પ્રીતી કાંઈ દશ્યમાન વસ્તુ નથી છતાં ક્યાંય દીડી નથી એમ એમ ગાયું ? તો તેના સમાધાનમાં કહેવાનું કે. એ અકૈાંક્ષિક સ્નેહ છે તે સ્વરૂપાત્મક છે. પ્રભુએ કહેતું છે જે સ્નેહ છે તે માણ સ્વરૂપ છે જેના અહોલાભ્ય હોય તેમને દશ્યમાન થાય. ગોવિંદહસળ જેવા માહાતુલાવી ઓને તેમના સાક્ષાત દર્શન થાય તેથી તેમણે ગાયું જે આવી પ્રીતી ક્યાંય દીડી નથી. વળી સાધારણ રીતિથી એવો પણ અર્થ થાય છે સ્નેહની ઉત્પત્તિ નેત્રોદારા થાય છે. તેમ સ્નેહ ટેટદો છે તેની પરિક્ષા પણ નેત્રોદારા તેમનું પરિવર્તન જેયાથીજ થાય છે તેથી કહ્યું જે એવી પ્રીતી ક્યાંય દીડી નથી. કેવી તે આગળ કહે છે જે (યશોમતિ સુત શ્રી વક્ષભ સુત જેસી શેષ સહસ્રમુખ જત ન દેખો) અર્થ:— શ્રીયશોદાળના પુત્ર શ્રી દાકોરણ અને શ્રીગુસાંધળની પરસ્પર જેવી પ્રીતી છે, તેવી પ્રીતી ક્યાંય દીડી નથી. શેષળ પોતાના હંગર મુખથી એ પ્રીતિનું વર્ણન કરે તો પણ તે દેખો ન જય. હવે એ કીર્તનના ખીજા ચરણને પુર્વાદ્ય કહે છે કે (આજા ભાગ ચયે શ્રીગોકુલ દ્વિર ક્રિર જાંક જીરાખન દેખો) અર્થ જાયારે શ્રી ગુસાંધળ શ્રીગિરીરાજ પદ્માંથ હોય ત્યારે એકાદ દિવસ ત્યાં રહી પાણ શ્રીગોકુલ પદ્મારતી વખતે શ્રીનાથછુની આજા વધને પદ્મારે છે, છતાં પણ શ્રીગુસાંધળ પદ્મારતી વખત શ્રી નાથળ જીરાખામાંથી જાંકી જાંકીને પણ શ્રી ગુસાંધળ તરફ જુએ છે કારણ કે પરસ્પર સ્નેહ છે તેથી તેમના સામુ જેયા કરે છે.

હવે ખીજા ચરણને ઉત્તરાદ્ય કહે છે:—

(સુનિયત કથા જરૂર ચાતકની કુમુદિની ચંદ્રચોર વિશેખી)

અધ્યાત્મ:—દૈલિકમાં પણ પ્રીતીવાળા વણું છે. તેમાં કૃષ્ણાકના નામ અને ગણુંબા છે. એકતો ધન ચાતકની પ્રીતી કેવી છે પ્રથમી માથે કૃષ્ણા નિર્મિત જરૂર છે તેની કોઈની તે ચાહના ન કરતાં કેવળ ઘનતીજ અનન્ય ચાહના કરે છે અને કુમુદિની કેતાં ચંદ્ર વિકાસી કુમલની પ્રીતી ચંદ્રમા સાથે હોય છે તેથી ચંદ્રોદાય થાય ત્યારેજ તે ખોલે તે સિવાય નહિ ભીસે એ તેની અનન્યતા તેમજ ચોર પક્ષી છે તે ચંદ્રમા સામુજ્જ જેઠ રહે છે ખીજ સામુ જોતો નથી એ એના સ્નેહની અનન્યતા છે. એવી રીતે ધન ચાતક કુમુદિની ચંદ્ર અને ચંદ્રચોરની પ્રીતી પણ અનન્ય અને અસાધારણ છે જીતાં પણ શ્રીનાથજીં અને શ્રીગુસાધજીની પ્રીતી જે પરસપર છે તે એવી પણ વિશેખ છે.

હુને એ કીર્તનના ત્રીજન ચરણના પુર્વિક્ષ કહે છે કે:—

(ધનકો કીયો સર્વે હૃદ્ય લાવત કરત શ્રંગાર વિચિત્ર વિશેખી)

ધનકો કેતાં શ્રીગુસાધજીનું કરેલું સર્વે શ્રીનાથજીને લાવે છે એટલે પ્રીય લાગે છે. તેનું ધારણું કે સ્નેહીનું કરેલું સાભા સ્નેહીને પ્રિય લાગેજ સિવાય શ્રીગુંસાધજી નિત્ય પ્રતિ નવીન નવીન વિચિત્ર ભાંતિના શ્રંગાર પ્રભુને ધરાવે છે તેથી શ્રીનાથજી બહુજ પ્રસન રહે છે. ભોગ રાગ અને શ્રંગાર પુષ્ટિમાર્ગના જેવું થવાનું નથી, હજ પણ આજ હિન સુધી શ્રીવક્ત્વાકુમના જ્ઞાનક આયવા! બહુ ઐટીઓ જ્ઞારે શ્રંગાર ધરાવે છે ત્યારે એવા તો એડોકિક દર્શન થાય કે ત્યાંથી આયા ખસવાનું મનજ ન થાય. તેમજ પ્રભુને અનેક પ્રકારની તરેતરેની સામગ્રી સિદ્ધ કરી શ્રાગીકાર કરાવવામાં આવે છે. તેમાંથી વણુંબણું

તરાઓના નામ પણ કાને સાંલળવામાં નહી આવ્યા હોય તો તેવો
ભોગ ઘીનું આવેજ ક્યાંથી અને કીર્તિનોમાં અષ્ટસખાયે જે પ્રભુના
ગુણાનુંયાદ ગાયા છે એવો ગાન પણ ચાચ તેવા નિપુણ ગવૈયાથી
નથી થાવાનું તાનસેન મોડો ઉત્તાદ ગવૈયો હતો. તેને શ્રીગુરુંધરજીએ
ગાવાનું કહ્યું ત્યારે તો જોવીદ સ્વામી શ્રીગુરુંસાઈજી આગળ ગાન કરી
રહ્યા હતા અને તાનસેન આંગ્રે એટલે તેને પણ ગાવાનું આપે કહ્યું
ત્યારે તાનસેને કહ્યું જે મહારાજાધરજ મખભક્તને કંઈ શુણીયાના
થીગડાં દેવાય. એટલે તેમનો કહેવાનો ભત્તાય એ છે. જોવિંદ-
સ્વામીનું ગાન મખભક્તના જેવું છે અને તેમની આગળ માં ગાન
દાર એટલે શુણીયાં અથવા ખારદ્વાન જેવું છે. એટલે મખભક્તને કંઈ
શુણીયાના થીગડાં હેવાય? તો અષ્ટસખાનું ગાન પણ ક્યાંય થબાનું નથી
કારણું કે અષ્ટસખા પ્રભુના અષ અંગ ૩૫ હતા તેથી તેમનું ગાન
રસ્સીપ હોય તેમાં કહેવું શું.

હું ત્રીજી ચરણના ઉત્તરાર્દ્ધમાં કહે છે કે—

(જોવિંદ જોવર્ધનને માંગત બિલ્કુરોપદ છુન અર્વ નિમિભી) (૨)

અર્થ—આ કીર્તિનની સમાધીમાં જોવિંદસ્વામી કહે છે. પ્રભુથી છુટા
પડવાપણું અર્વ નિમિપ. આંખની ચાંપણું શ્રીચાચને પાણી ખુલે તેને
અરધારૂસમય ચુંની પણ ન થાયો એવી રીતે હશિરાસ વર્ય એવા
ગિરિજાજી પાસેથી માંગણી કરી છે.

(સુભૂત્સ.)

આશ્રયનું કીર્તન.

રાગ—મિહાંગ.

લજ સખી ભાવ ભાવિક દેવ,
કોટિ સાધન કરે। કોઉ તોઉ ન માને સેવ. (૧)

ધૂમ દેતુ કુમાર માંચ્યો કોન મારણનીતી,
પુરુષ્ઠેં શ્રીય ભાવ ઉપજ્યો સણે ઉલટી રીતી. (૨)

અસુન ભૂષણુ પલટ પેહેરે ભાવકે સંભેગ,
ઉલટ સુદ્રા દઈ અંડન વરણ સૂધે હોય. (૩)

વેહ વિધિકો નેમ નાહીં પ્રીતકી પહેંચાન,
નજીવધુ અસ કીયે મોહન સૂર વતુર સુનત. (૪)

(લજ સખી ભાવ ભાવિક દેવ) એક સખી ખીજ પ્રતી કહે
છે જે આપણા પ્રભુ ભાવિક દેવ છે તેનું સમરણ લંજન ભાવસહિતકર.

આપણા પ્રભુ પુષ્ટિ પુરુષોત્તમ ભાવાત્મક છે તેથી ભાવિક દેવ
કહેવાય છે ને ગોપીજનનો આ પુષ્ટિ ભક્તિમાર્ગ પણ ભાવાત્મક છે.
હવે ભાવ એટલે શું. પ્રીતો, સ્નેહ, પ્રેમ એ અથે ભાવ શરૂદના અર્થ
છે. તો સ્નેહ અથવા ભાવ એ સર્વોપર વસ્તુ છે. તે કોડિક સ્નેહ છે
તે તુચ્છ છે. પ્રભુ અંધેરી સ્નેહ તેજ સર્વોપર પદાર્થ છે, તુંતે વિરો
પંચમૂત અંથમાં વ્યાસ આવા કહે છે જે—

(સરપણોય સો જરૂ ભદ્રો તાકો કહે દુઃખ રોય, જવિદુઃખ
અયો કંદા કામદો જ ઘર રસ નહી હોય) વ્યાસ આવા કહે છે જે
(સરપણ) એટલે રસસહિત હોય તે જરૂ હોય અથવા જરૂ જેવો હોય
તો પણ સારો કારણ પ્રભુના શરીરક જન એટલે સ્નેહીજન છે તેમને

પ્રભુના વિશેગ સંઅધી પૂરી અથવા ને દુઃખ થાય છે તે પોતાના જેવો રસીકરણ મળે તો તેની આગળ એ પોતાનું દુઃખ રોઈ રહીને પણ કહેવાય. પણ કોઈક વિશેગ દુઃખથી લરેસે શું કામતો કે જેના ઘટમાં રસ એટલે પ્રભુ સંઅધી રનેહન હોય તે શું કામતો? એટલે તે રસિક જનતે કશા ઉપશેગનો નથી. વળી પંચામૃતમાં કહેલ છે:—

(જલ ન કુઝાવે કાષદ્રો કહે કદાંડી પ્રીતી અપતો સીંઘો જનકે યહ અડેનડી રીતી) જલ કાષને કુઝાવતો નથી, તો કાષદી અને જલની ક્ષયાંની પ્રીતી છે એમ શાંકા થાય તો કહે છે કે જલના સીંઘનથી કાષ થયો છે તેથી જલ તેને તુરે છે પણ કુઝાવતો નથી એ મોટા પુરુષોની રીતી છે, આ ઉપરથી એમ સમજવાનું છે કે ૧૧૫ પદાર્થોમાં એટલી સ્નેહની અસર છે તો આપણામાં ટેટલી જોઈયે.

આપણું પ્રભુ સ્નેહે કરીને મુરિપુર્ણ છે તેથી ભાવિક દેવ કહેવાયા. કહેવત છે કે (જલ કુવામાં હોય તો અવાગમાં આવે તેવી રીત ભાવ પ્રભુમાં સંપૂર્ણ હતો તો તેમના દાન કરવાથી ભાવ નામતી વસ્તુ જોગીજનમાં પણ આવી. ભાવની ઉમતીજ પ્રભુથી છે તો એ ભાવિક દેવની પ્રાપ્તિ પણ ભાવવિના ધરીતર ક્રાઇ પણ પ્રકારથી ન થાય. સૂરદાસજી લીલામાં બંપદકતા સખી હતા તેથી તે ભાવમાં ભગ્ન થઈ બીજુ સખીને સંણોધી શરણુસ્થ છુંબો પ્રતી કહે છે જે હે સખી આપણું અકોઈક પ્રાણું પ્રતિ એવા પ્રભુ ને ભાવીક દેવ છે તેમનું સુરણુસ્થ ભજન ભાવ સહિત કર. હવે આ ઠેકાણું ભજ શરણ કર્યો છે તે ભજ સેવાયાં ધાતુ છે તેનો અર્થ સેવા અને ગુણગાન અન્ને થાય છે એટલે ભાવ શહિત પ્રભુની સેવા અને ગુણગાન કર.

ભજ શાંમદનો અર્થ સેવા અને ગુણુગાન અને ધાર્ય છે.
 (મંગદાથી શાજલોગ ચુંબી અને ઉત્થાપનથી સેન ચુંબી)
 સેવા કરતાં સંપ્રેષણ રમણો અતુલસ કરવો અને શાજલોગ પણી અનો
 સેન પણી અનોસરમાં વિપ્રેષોગ રમણો અતુલસ જેમ ગોપીજનો
 (કેળુંગીત યુગદગીત ગોપીકણીત) ગાંઠને કર્ઝો તેમ કરવો, તે ગુણુ-
 ગાન સમજવું મારે સેવા અને ગુણુગાન અન્ને કરવા તે પણ આવ સહિત
 કરવા, આવ વિના સર્વ નકાસું છે. તેથી ભાવસહિત ભજવાનું કહ્યું છે.
 હવે પ્રથમ ચરણનું ઉત્તરાઈ કર્ફે છે.

(ડોટિ સાધન કરો ડોડિ તોડિ ન ભાને સેવ; આ પ્રથમ
 ચરણના પુર્વિક્રિમાં કહ્યું જે ભાવિક દેવનું ભાવસહિત સમરણ ભજન
 કર, તે પ્રમાણે ભાવસહિત સમરણ ભજન ન કરતાં ડોઈ ડોટાન ડોટિ
 સાધને કરીને ભજે તો તેને પ્રભુ પોતાની સેવા તરીકે ભાનતા નથી.

અને ભાવ કહેતાં રનેહ સહિત કરેલી (રાઈ અતી સેવાડો
 ફૂલ ભાનત મેર સમાન) રાઈ જેટલી સેવાને પણ પ્રભુ મેર પર્વત
 સમાન ભાની લિયે છે.

હવે એ કીર્તનો ખીજે ચરણ કહે છે કે:-

દૂધકેતુ કુમાર ભાગ્યો ડોન આરગ નીતિ;
 પુરુષ તેત્રીય ભાવ ઉપન્યો સણે ઉલટી રીતિ.

સોગ હજાર અભિકુમાર દંડારણમાં તપશ્ચર્યા કરતા હતા.
 ત્યાં રામચંદ્ર પધારી તેમને દર્શન દીધા અને વરદાન ભાગવાને કહ્યું.
 તે વખતે રામચંદ્ર મર્યાદ પુર્ણોત્તમ હોતાથી તેમનું ડોટિ દંડ્ય-
 ક્ષાવણ્ય સ્વરૂપ જોઈને અભિકુમારો મોહને ગ્રામ થયા અને એ ભાગ્યં
 કે, અમે તમારી હાસીઓ થઈયે. ત્યારે રામચંદ્રને કહ્યું છે કે

સારસ્વત કદમ્પને વિષે કૃષ્ણાવતાર સમયે તમારી અંગીકાર થશે. એમ વરદાન આપ્યું. તો ધૂમકેતુ કહેતાં એ અનિદુમાર પુરુષ હતા, છતાં સ્વીલાલ ઉત્પન્ન થયો, એ પુણિ અક્ષિભાર્ગની રીતી એજા માર્ગથી ઉકટા પ્રકારની છે.

હવે જીજે ચરણ કહે છે:—

અસત લૂપણુ પદ્મએ ખાલ કે સંજેગ;
ઉકટ સુદ્રા દઈ અંડન બરત સુવે હોય.

અર્થ—પ્રભુએ જ્યારે મોરકી નાદ કર્યો, ત્યારે ગોપીજનો પ્રભુના જ્ઞાતમાં નિમન્ન થઈ ગયા, તેથી તેમને જ્ઞાન રહ્યું નહીં. એટસે ઉત્તાપણથી વન્નાલુષણુ આડાઅવળાં ધારણુ કરી લીધા. પણ તે પ્રભુ સંમુખ જતાં સવળાં થઈ ગયાં તે કેમ કે જેમ છાપમાં ઉંઘા અક્ષર ઝાતરેલા હોય છે. પણ તે કાગળમાં છાપે ત્યારે જેમ સવળાં થઈ જય છે, તેમ ગોપીજનના અવળાં વન્નાલુષણુ પ્રભુ સંમુખ જવાથી સવળાં થઈ ગયાં તો પ્રભુ સંમુખ રહેતારનું પ્રભુ સંબંધી કાર્ય અવળું હોય તો પણ જગતનું સંમુખતાથી સવળું થઈ જય.

હવે એ કીર્તનનો ચોણ્ણ ચરણ કહે છે:—

વેદ વિધિઓ નેમ નાહીં પ્રીતીકી પહેંચાન;
મજાખદુ ખુસ કીર્યેં મોહન સૂર ચતુર સુજાન.

અર્થ—વેદમાં જે કરવાનું કહ્યું હોય તે વિધી કહેવામ છે, અને જે ન કરવાનું કહ્યું હોય તે નિષેધ કહેવાય છે. તો કહે છે કે, જ્ઞાવિક દેવને વેદની વિધાયી પણ લાણ્યા નથી જતા. એ તો કેવળ પ્રીતીએ કરીને પહેંચાન્યા જય તેમ છે. મજાખદુ કહેતાં ગોપીજનોએ કુનળ પ્રીતીએ કરીનેજ એ ચતુર સુજાન અને મોહન એવા પ્રભુને

વસ કીધા, હવે આ દેકણે મોહન શખણ શા માટે કહ્યો છે, પ્રભુ છે
તે આખા વિશ્વને મોહ પમાડનાર છે. તેવા પ્રભુને પણ ગોપીજનોએ
પ્રેમ વડે મોહીત કરી વસમા કરી લીધા. તે કિંબ રાસ પંચાધ્યાયીમાં
ગોપીજનો પ્રતી પ્રભુએ દેહેત છે કે, (સંકલવિશ્વ આપ વશકર મોહી
માયા સોહેત હેં, પ્રેમમયી તિકારી માયાસો મોહી મોહેત હે.) પ્રભુ
કહે છે જે મારી માયાએ કરીને આખા વિશ્વને મેં મોહિત કરી
લીધા છે. પણ ગોપીજનોને કહે છે જે હે ગોપીજનો ! આ પ્રેમમયી
તમારી માયાએ મને પણ મોહી લીધો છે. તો પ્રભુ ચતુર શિરોમણી
હોવા છતાં પ્રેમના વશમાં થઈ ગયા, પ્રેમ વિના કોઈ પણ પ્રકારથી
વશમાં ન થાય,

(સંપુર્ણ)

— — — — —

હિલગણું કીર્તન.

(રાગ ધૂન્યાશ્રી.)

હેં નંદલાલ વિના ન રહું ॥

મનસા વાચા ઓર કર્મણું હિતકી તોસોં કહું. (૧)

જે કષુ કહેણ સોઈ શિર ઉપર સોહેં સબે સહેં ॥

સહા સુભીપ રહેં શ્રીગિરિધરકે સુંદર વહન ચહું. (૨)

યહુ તન અર્પણ હરિઝાં ઝીનો વહુ સુખ કહે લાહું ॥

પરમાનંદ મહનમોહનકે ચરણ સરોજ ગહું. (૩)

હેં નંદલાલ વિના ન રહું :—

રાઘવાર્થ—એક વિરહી વજલકૃત પોતાના જૈવા ભાવવાળા
ખીજ વજલકૃત પ્રતિ કહે હું નંદલાલ વિના નથી રહી શકતી.

દીકા—અતે પ્રથમ (હિ) શંખ કહ્યો છે તે તો અભિમાનનું વાયક છે તે કેમ કહ્યો હશે એવી શંકા થાય તો ત્યાં કહે છે એ ભક્ત પોતે અનુભવી રહેલી પોતાની દશા પોતજ જણી શકે છે. બીજે કોઈ જણી નથી શકતો તો પોતાની દશાસૂચન કરવાને ખાતરજ અવ હોં શંખ કહ્યો છે. સિવાય તેમાં અભિમાન તો થું પણ અભિમાનની ગંધ સુધ્દા તેમાં નથી. વળી એમ પણ શંકા થાય છે ને પોતાની દશા બીજાની આગળ કહેવાતું પ્રયોજન થું ત્યાં જણુવાતું કે ભક્તજતોને પ્રભુના વિરહમાં પારવાર પીડા થાય છે તે ન્યારે પોતાના જેવા ભાવવાળી બીજ મળે તેની આગળ પોતાતું દુઃખ રોઈ રહીને કહે ત્યારેજ તેને કાંઈક આખાસન મળે છે, તેથી કરીને કહેવું પડે છે. કહ્યા સિવાય (સ્વરસ્થતા નહીં મન્ત્રતી હોવાથી) તેનાથી રહી શકતું નથી. પછીનો શંખ (નંદદાલ) છે તો એ વજાભક્ત કહે છે. ને નંદદાલ આંધણા સર્વના અદૈાડિક પતિ છે. શાસ્ત્રમાં પતિ શંહના અર્થની તપાસ કરીયાં તો જણાશે કે કાદ્ય કર્માદિકના ભયથી મુક્ત કરે તેજ પતિ કહેવાય તો તેવી સામર્થ્ય તો કેવળ પ્રભુમાં છે. બીજ કોઈમાં નથી. માટે નંદદાલ એવા પ્રભુ આપણા સૌના અદૈાડિક પતિ છે. તેમના વિના ન રહી શકાય તો પતિવૃત્તા ર્ખીને પોતાના અદૈાડિક પતિ વિના ન રહી શકાય. એનાથી વળી ઉત્તમ બીજું શું હોઈ શકે? કાંઈજ નહીં એજ એના માટે સર્વોપર દશા છે તે પોતે અનુભવી રહી છે, તેનું સૂચન બીજ સખીને સંગોધી શરણુસ્થ શ્રવ પ્રતિ કહે કે ને પ્રભુ વિના આપણાથી ન રહી શકતું જોઈએ.

હુંને એ વજાભક્તને પોતાની દશા પોતાના જેવા ભાવવાળી

ભીજુ સખીને કહી સંભળ વે છે તે એવી રીતે એ પ્રથમ ચરણના ઉત્તરાર્ધમાં કહે છે કે:—

(મનમા વાચા ઓર કર્મણુ હિતકી તોસો કહું.) શાખાર્થ—
 એ મ્રજલકૃત પોતાની દશા ને ભીજુ સખીને કહી સંભળવે છે તે તે
 એવી રીતે કહે છે કે, મન કર્મ અને વચ્ચન, એ નણેની એકતાથી
 હિતની વાત કહે છે. હવે સંસારી જનોનું કહેલું કેવા પ્રકારનું
 હોય છે કે મનમાં હોય એક વચ્ચનમાં, વળી ભીજું અને કીયામાં, વળી
 નીજું એ તો કપ્યર્ડ્યપ ગણ્યાય; તે દ્વારાદિકમાં પણ સુદ્ધ નથી ગણ્યાતું.
 તો અદ્વીક્તિકમાં તેવા પ્રકારનું કહેલું કેમ શુદ્ધ ગણ્યાય. શુદ્ધતા તો
 મન વચ્ચન અને કર્મ એ નણેની એકતા વિના ન થાય, તેથીજ એ
 મ્રજલકૃત મન વચ્ચન અને કર્મ એ નણેની એકતા કરીને કહેલું છે.
 એ ગોપીજનતું કહેલું અતિ ઉત્તમોત્તમ પ્રકારનું છે. આપણા આ
 પુષ્ટિ-ભક્તિમાર્ગમાં ગોપીજનતી જેવી રીતી રાખેને છે અથવા
 પુષ્ટિલક્તિમાર્ગજ ગોપીજનતો છે. મ્રજલકૃતનું કહેલું એટલે વાણીનો
 ઉચ્ચાર જન્મારે મન કર્મ વચ્ચન એ નણેની એકતાથી છે તો પણ
 પુષ્ટિમાર્ગમાં તમામ ઝાર્થ મન વચ્ચન કર્મ એ નણેની એકતાથીજ
 હોવા જેઠાએ. એ નણેની એકતા વિના પુષ્ટિ-ભક્તિમાર્ગમાં એક
 ડગણું પણ ન ભરી શકાય. એ લાન પણ ઉપકા વાચ્યમાં સમાયલો છે.
 તે પછી (હિત) શાખા છે એ મ્રજલકૃત કહે છે ને આપણા હિતની
 વાત હું તને કહું છું. હવે અદ્વીક્તિ પતિ એવા ગ્રસુ વિના ન રહેયાય.
 એના જેવું હિત પતિવૃત્તાને માટે કહું હોઈ શકે? કોઈજ નહીં, એજ
 મોટામાં મોટું હિત છે. તો (હિતકી તોસો કહું) એટલે તને કહું છું.
 એમ કહું તેનું કારણું કે, હિતની વાત પોતાની હિતુ હોય તેની

આગળજ કહી શકાય. ખીજની આગળ ન કહેવાય, તેથી પોતાની હિતુ હતી તને એ વાત સાંભળવાની ઘોષતા હોઈ શકે. ખીજને નહીં તેથી કહું કે તું મારી હિતુ છો, તેથી હિતની વાત તને એટલે તારી આગળજ કહું છું. ખીજની આગળ હિતની વાત નજ કહેવાય એ ભાવ પણ સમાયદો છે.

હવે ખીજ ચરણુનો પુર્વિક્ષે કહે છે કે—

(ને કહું કહો સોઈશિર, ઉપર સો હોં સબેં સહોં) આ પ્રજલકણ કહે છે ને આપણું અદ્વાદિક પતિ એવા પ્રલુબ વિના મારાથી ને નથી રહી શકતું એ દશા સરોપર છે. જેનાં અહોભાગ્ય હોય તને આવી દશા પ્રાપ્ત થાય છે પણ તે સંસારી જનને નહીં ભાવે કહેવત છે કે (ભક્ત જગતધી બાતમે હેત પરસ્પર વેર, વેવાડું મોડી કહેવે વાડું કહે નેર.) અર્થ—ભક્ત અને જગત એટલે હુતીયાના લોડો અથવા સંસારી જનોની વાતોમાં પરસ્પર વિરોધી હોય છે. સંસારી જનોને ને અમૃત નેવું પ્રીય હોય છે તે ભક્ત જનને કરું જેર નેવું લાગે છે અને ભક્ત જનને અમૃત ઇપ હોય તે સંસારી જનને ન સોદ્ધાય એ રીતીજ છે તેથી તેઓ આડો અવળો વાતો મારા વિષે કરશે તે લકે કરે. તેની મને દરકાર નથી. તેઓ ને કાંઈ કહેશે તે હું સર્વ મારું ભર્તક ઉપર ચઢાવી લઈશ અને સહન કરી લઈશ પણ અમુક કાર્ય કરીશ તે એ ચરણુના ઉત્તરાર્થમાં કહે છે કે—

(સદ્ધ સમીપ રહ્યોં શ્રાગિરિધર કે સુંદર વદન ચહું,) સહી સર્વદા પ્રલુની સમીપમાં રહ્યા કરીશ અને શ્રી ગિરિધર એવા પ્રલુના મુખાવિનાં અવલોકનની ચાહના સદ્ધ કરીશ. હવે સમીપ શાન્દનો એવો

પણ ભાવાર્થ થાય છે ને લકે પ્રભુથી દૂર હોય પણ અષ્ટ
પ્રહર પ્રભુનું જે સમરણ રહ્યું આવે તો તે દૂર નથી પાસેજ છે તે
વિષે પંચામૃતમાં વ્યાસ ભાવાએ કહેલ છે કે—

(સજજન યેં મતિ જનીયો દૂરદેશએ, વાસ નેનઙ્ગે
અંતર લયો પ્રાન તુમારે પાસ.) અર્થ—વ્યાસ ભાવા કહે છે કે હે
સજજનો ભગવાનીઓના સજજન લક્તાજીનજ હોય તો લક્તાજીન
પ્રતી એમનું કહેવું છે ને તમારા મનમાં એવી રંગ ન લાવવી
ને જેની સાથે સ્નેહ છે એવા પ્રભુ આપણાથી દૂર છે એમ ન
જાણવું, નેત્રોને માત્ર અંતર છે પણ આપણા પ્રાણ તો તેમની પાસેજ
છે, વળી કહ્યું છે ને (જખમે વસે કુમુદિની ચંદ્ર ખસે આડાશ,
નોજન જાકે મન ખસે સોજન તાકે પાસ.) અર્થ—કુમુદિની ડેતાં
ચંદ્ર વિકાસી કમશ તો જખમાં વસે છે અને એમણે જેની સાથે
સ્નેહ કર્યો છે એવો ચંદ્રમા આડાશમાં વસે છે તો અંથાં પૃથ્વી
માથેનું જલ અને કંધાં આડાશમાનું ચંદ્રમાં પાર વિનાનું દૂર છે છતાં
એ કંભલનો સ્નેહ ચંદ્રમા સાથે છે તેથી ચંદ્રમાં તેના મનમાં વસે
છે તો ને જન જેના મનમાં વસે તે તેની પાસેજ છે. તો આપણું
મન પ્રભુમાં હોય અને અષ્ટપ્રહર પ્રભુનું સમરણ રહે તો પ્રભુ દૂર
હોય તોપણ તે દૂર નથી પાસે છે અથવા સમીપમાં છે. એમજ
કંઈ રાકાય કારણું કે મનમાં વસી રહ્યા છે મારે પાસેજ છે
તેથી ગોપીજને કહ્યું કે શ્રીગીરીધર એવા પ્રભુની સમીપમાં રહ્યું અને
તેમના સુંદર એવા સુખાર્વિદ્ધની ચાહના કરે એમ કહ્યું કારણું કે
પ્રભુના સુખાર્વિદ્ધના જેવી સુંદરતા વ્રીદોદીમાં કયાંથ નહી ભગે સવો-
હૃદ એ સુંદરતા છે. પ્રભુના સર્વાંગ અતિ સુંદર છેટિકિંદ્ર્ય, લાવણ્યના.

જેવા સુંદરતાવાળા છે તો એવી આપના મુખાર્વિદ્ધિ સુંદરતાનું શું
કહેવું ? અધિકારીધિક અધિક અધિક સુંદરતા છે તેથી કહું કે પ્રભુના સુંદર એવા વદન
દ્વારા મુખાર્વિદ્ધાવસોદન એટલે મુખાર્વિદ્ધના દર્શનની ચાહના તો કરીશ,
હવે એવે પ્રભુના રસ્વાગ સુંદર છે છતાં મુખાર્વિદ્ધના દર્શનની ચાહના
શા મારે કરી છે કે મર્યાદાભક્તિ છે તે ચરણાભક્ત છે અને પુષ્ટિ લક્ષ્ણ
છે તે મુખાર્વિદ્ધાભક્ત છે. તેમ ચાહના કરવાવાળા પુષ્ટિલક્ષ્ણ ગોપીજન
છે તેથી તેમણે મુખાર્વિદ્ધની ચાહના કરી છે. તે પણ કોઈ રીત કે એ
કાર્ય મારે સિદ્ધ થવાને મારે કોઈક જરૂર કરવાં વચ્ચન અથડા જે
કાંઈ કહેશે તે મારા ભરતક ઉપર ચડાવી આને સહન કરી લઈશ પણ
પ્રભુની સમીપ રહી આપના મુખાર્વિદ્ધના દર્શન તો અવશ્ય લોક
સંક્રાચ તળુને પણ કરીશ. કારણ કે જે લોક લનજને સંભાળવા
જરૂરી તો પ્રભુનું મળવું થાતું નથી. તે વિષે એક કીર્તિનમાં કહેલ છે
ક (લાજ કૃષે હુઃખ પાછ્યે જિન મિલે હોય અકાજ) અર્થ—લોક
લનજન કરેથી પ્રભુનું મળવું ન થાય એટલે આપણું અકાજ થાય
અને હુઃખ થાય તેથી લોકલાજ તળુને પ્રભુને મળવું. તેમ આ ભક્ત
પણ બધું સહન કરીને પણ પ્રભુના મુખાર્વિદ્ધની જાંખી કરીશ એમ
કહું એને શ્રી ભક્તપ્રભુજી પણ પ્રભુના મુખ રૂપ છે તે વિષે સર્વો-
ત્તમજ્ઞાના આપનું નામ (શ્રીકૃષ્ણાસ્ય) શ્રી ગુસાંધાજી કહેલ છે તેમની
ચાહના કરવી. હવે એ કીર્તિના ત્રીજી ચરણનું પુર્વિદ્ધ કહે છે કે—

(યહ તન અર્પણ હંદિએ કીનો વહ સુખ કહા લાડ) એ પ્રેરણ
ભક્ત કહે છે જે આ દેહ પ્રભુને અર્પણ કરી તે સંબંધી સુખ જે પ્રાપ્ત
થયું તેનું વર્ણન થઈ શકે તેમ નથી કારણ કે તે વખતે તો અન-
તાર દ્વારા હતી તેથી વજલાંકતો પોતાની દેહ સાક્ષાત અર્પણ કરી હતી
તેથી તે અર્પણ કર્યો સંબંધી જે સુખ થયું તે સુખનું વર્ણન ન

થઈ શકે એમ કંચું પણ હમણાં તો અનવતાર દશાનો સમય છે તો આ વખતમાં આ દેહનું અર્પણું કેમ થાય કે આપણે અલસંઅંધ લેતી વખતે દેહ, પ્રાણ, ધૂદીય, અંતઃકરણ, રૂપી, ધર્મ, મુત્ર, દવ્ય, આત્મા સહિત સર્વ પ્રભુને અર્પણું કરી ચુક્યા છીએ. ત્યારથી સર્વ પ્રભુનું છે, આપણું કાંઈ નથી. છતાં પણ સર્વમાં પોતાપણાનું મમત્વ રાખી એહા છીએ એજ ઓડું છે. આવું ઓડું મમત્વ શાથી થાય છે કે આપણું અર્પણું કેવળ વચ્ચનથી ગદગનો રહોક ઓલીનેજ માત્ર કરેલું છે. તેને અતુસરીને મનથી અને કીયાથી જે અર્પણું હમેશાં કરતા રહીએ તો અર્પણું મન કર્મ અને વચ્ચન ત્રણેની એકતાનું થાય. તેવા પ્રકારથી જે દેહ હમેશાં ત્રણેની એકતાથી હરીસેવામાં જે લાગી રહે તોં તે અર્પણું સાચો અથવા પરિપક્વ દશાનો કહેવાય. તેવા પ્રકારથી જે આ દેહ અર્પણું કરાય તો પછી તે હેઠને જે કાંઈ સુખ થાય તેનું વર્ણન ન થઈ શકે. વર્તમાનકાળમાં પણ તેવા પ્રકારથી જે અર્પણું કરે છે, તેને અપુર્વ સુખ ભણે છે તે તેજ જાણી શકે. કારણું કે, જેને જે વાતનો અતુલવ થાય તે તે વાતને જાણી શકે બીજે ક્યાંથી જાણી શક્ક તેથી શ્રીયમુનાજીના પદમાં કહું છે કે, (અતુલવી વિના અતુલવ કહા જાનારો, જાણો પિયા નાછી ચિત્ત ચોરે.) અર્થ-નયાં સુધીને અતુલવ નથી થયો તો તે જન વિના અતુલવની વાતને થું જાણી શકે? અતુલવી હોય તેજ જાણી શકે; વિના અતુલવી નજ જાણું. અતુલવ હોને થાયું કે જેનું ચિત્ત પ્રભુએ ચોરી લીધું હોય, એટલે જેનું ચિત્ત અષ્ટપ્રહર પ્રભુમાં લાગેલું હોય તેને અતુલવ થાય. બીજાને ન થાય. માટે અલસંઅંધમાં દેહ પ્રભુને વચ્ચનથી અર્પણું કરી ચુક્યા છીએ, ત્યાર પછીથી આ દેહ પ્રભુની છે, માટે અષ્ટપ્રહર મન, કર્મ, વચ્ચનથી પ્રભુસેવામાં વિનિયોગ રાખીએ તો પછી એ હેઠને જે અપુર્વ સુખ ભણે તે કહું ન જય. તો એવા સુખ ભળવાનો ઉપાય એ છેલ્લા.

ચરણના ઉત્તરાધિમાં કહે છે કે, (પરમાત્માને મદનમોહનને ચરણ સરોજ ગાહું.)
આ કીર્તાનની સમાપ્તિમાં પરમાનંદસલ્લ કહે છે જે ઉપર વર્ણિન
કરી આવ્યા તે દેખ આપ્યાનું અપુર્વ સુખ પ્રાપ્ત થવું એ સાધન
સાધ્ય નથી, પણ કૃપાસાધ્ય છે. માટે આપણે તો પ્રલુનું ચરણશરણ
જે હઠ રિતે અદ્યા કરશું તો તે પ્રલુનું દ્વારા છે. માટે દ્વારા આણી
જરૂર કૃપા કરશે. આપણને એ વન્તુ દુર્લભ છે, પણ પ્રલુનું કૃપા કરે
તો સુખભ થઈ જય, અને ચરણશરણ હઠ કરીને થહીયે તો પ્રલુનું
કૃપા પણ જરૂર કરે. તેથીજ અને કહું ને ચરણકમદને ગાહું એટસે
હઠ કરીને એમનું ચરણશરણ અદ્યા કરે.

(સાધુષ્ણ)

હિલગણું કીર્તાન.

રાગ-ઘિલાવલ.

લગન	મન લાગી હો લાગી ॥
કહો	કરેગે લોગ મેરા ॥
હોં	પ્રીતમ રસ પાગી. (૧)

કષ્ટ ન સુહ્યાય જય ન કહું મન ॥

એરસ જની આઈ અનમાગી ॥

અથ ધંરીયત ચિત્ત આસપાસ રહિયે ॥

રસિક	પ્રીતમ ખડ લાગી. (૨)
------	---------------------

(લગન મન લાગી હો લાગી) અધ્યા-લભિ એટદે સ્નેહ તે ક્યારે થાય
કું અભિ વિના લભિ ન થાય. એ અભિ કથ કે પ્રલુવિયોગ સંખ્યે
તાપભિ અંતરમાં થવી નેધારે, તો તે દ્વારા સહજ સ્નેહ અથવા અપુર્વ
સ્નેહ ને પ્રલુભાં થાય તે લભિ કહેવાય; તો એક પ્રજલકને ધીજન પ્રજલકની

પ્રતિ કહે છે જે ભાગ મનને તો પ્રભુ સંબંધી લભિ લાગી તે લાગી, હવે કાંઈ એ મટવાની નથી. કારણું કે પ્રભુ સંબંધી લભિ એવી છે કે એ લભિ જેને વાગે છે તેને પાછી કોઈ કાળે મટની નથી. દૈદિક સ્નેહ તો કેવે! હોય છે કે ક્ષણુંના ઉત્તરે છે અને ક્ષણુંના ચઠી જથ્ય છે. તો તેવા સ્નેહને તો સ્નેહની ગણુત્તીમાંજ નથી ગણ્યો. તે વિષે એક અક્તાજન કહે છે કે:—

છિનુ ઉત્તરે છિનુહી ચડે સોઢી પ્રેમ નહીં હોય;
નિસ વાસર ભીજ્યો રહે પ્રેમી કહીયે સોય.

અર્થ—ક્ષણુંના સ્નેહ ચઠી જથ્ય અને પાછો ક્ષણુંના ઉત્તરી જથ્ય, તેને તો પ્રેમ ન સમજવો પણ રાત દ્વિસ પ્રેમમાં લીજાયદો ને લીજાયદો રહે તે પ્રેમી કહેવાય. ભારે પ્રભુસંબંધી જે સ્નેહદ્વારા લભિ જેને લાગી તે લાગી તે પાછી કોઈ દ્વિસ મટતી નથી.

હવે ગ્રંથમ ચરણુંનું ઉત્તરાર્થ કહે છે કે:—

(કહા કરેંગે લોક મેરો હેં શ્રીતમ રસ પાગી.:) એ અકૃત કહે છે જે ભાગ મનને જે પ્રભુસંબંધી લભિ લાગી છે તે હુનિયાંના લોકો અથવા સંસારી જનોને નહીં સોણાય; એટસે અસદ્ય લાગશે, તેથી તેઓ ભારે શું કરી નાખવાના છે? હું તો પ્રાણપીતમ અદ્વીકિક પતિ એવા પ્રભુના રસમાં પગી થઈ એટસે નિર્માચ થઈ ગઈ છું. તે કેવી રીતે કે જેવી રીતે ગુડના રસમાં કીડી મળી જથ્ય તો પછી તેમાંથી કોઈ પ્રકારથી તે નીકળી શકતી નથી, તેવી રીતે હું તો પ્રભુના રસમાં પગી ગઈ. તેથી હવે એમાંથી નીકળવાની નથી.

હવે ખીજ ચરણુના પુત્રાર્થમાં કહે છે કે:—

(કષ્ટું ન સોણાય જથ્ય ન કરું મન, એસી અની આદ્ય અનમાગી.:) ગ્રંથમના ચરણુંના કલ્પા પ્રમાણે મનને પ્રભુની લગ્નની

ખાગી ગઈ, તેથી પ્રભુના રક્ષણાં કું પગી ગઈ હું. તેથી હવે મને
પ્રભુ વિના બીજું કાંઈ સોઢાતું નથી, અને માંડ મન પ્રભુ વિના
બીજે ક્રાંય જતું નથી. તો પ્રભુ વિના કાંઈ પણ ન સોઢાતું અને
પ્રભુને મુક્તી મન ચાન્દ્યોળ ન જતું, આત્મા જેવી દળી ઉત્તમ દ્વારા
કાઈ હોઈ શકે? કોઈજ લદ્દો, એવી દ્વારા ઉત્તમોત્તમ છે. આવી ઉત્તમ
દ્વારા પ્રાપ્ત થવાને મારે વાણ્યાએ તર્થી કરે છે, અને એ દ્વારાની પ્રાપ્તિને
મારે અનેક ધર્મો કરે છે હતાં તેઓને આવી દ્વારા પ્રાપ્ત થતી નથી.
કારણું કે, એ વસ્તુ સાધનસ્તાધ્ય નથી કૃપાસાધ્ય છે. તેથી પ્રભુને
હાથ છે. તો કોઈને શંકા થાય કે પ્રભુની આગળ આ વન્તુની
માગણી કરીયે તો પ્રાપ્ત થાય ત્યાં સમજવું કે માગવું એ પુષ્ટિની
ધર્મ નથી. એક કીર્તનાં કહેલ છે જે (માગે સર્વાસ્ત્ર જતકે પરમા-
તંદ લાંબે.) આપણે પ્રભુભેવા કે પ્રભુભક્તિ કરી એના અદ્વામાં
કાંઈ માગી શીધું એ તો વ્યાપાર જેવું ગણ્યાય, જેમ પેસા આપીને
ચીજ લીધા બગાબર થાય અને સેવાનું કલ શીધું ચાલ્યું જય, તેથીજ
કહ્યું જે માગે સર્વાધ્ય જતકે, તેમજ માંગવાથી નિર્ભક લાય જતો
રહે તેમ પુષ્ટિભક્તિમાર્ગ છે. તે નિર્ધાર લક્ષ્ણમાર્ગ છે. તે માણ્યાથી
સકામપણું થઈ જય અને અજમાગી શું જણે એ સર્વ પ્રકારથી
શરણુસ્થ હવે કોઈ પણ ગ્રઙ્ઘનથી પ્રભુની આગળ કાંઈ પણ માગવું
ઉચ્ચિત નથી, પણ પ્રભુસંબંધી સર્વ પ્રકારના સુખની અંતરમાં
આહના રાખવી. અંતર્થીની અંતરની જાહી સ્વધારાથી ચોતાની મેળે
આપણી ધર્મશાસ્ત્રાથી પણ ગાંધિક સુખ કૃપા કરીને વિના માગે
આપશો. તેવીજ રીતે આ લક્ષ એણ કહે છે. પ્રભુ વિના કાંઈ ન
સ્વોધાય અને એમના સિવાય મન ચાન્દ્યોળ ન જય, આવી દ્વારા પ્રાપ્ત

થવી આત કહેણુ છે, છતાં પ્રભુએ પોતાની ઘણ્ઠાથી કૃપા કરી વગર
માઝે આવી દ્વારા મને પ્રાપ્ત કરી છે, તેથી કહું જે (એસી અતી
આઈ અન્માગી.)

ધીન ચરણુના ઉત્તરાર્દ્ધમાં કહે છે:-

(અમઃ ધરીયત ચિત્ત આસપાસ ગહિયે રસિક પ્રીતમ અહભાગી.)
આ કીર્તન શ્રીખિરિયજીનું કહેણુ છે, તે ઓ કીર્તનની સમાપ્તીમાં
જે સક્તા કહે છે. ને હવે તો મનમાં એવી ધારણા થાય
છે, પ્રભુની આસપાસમાં જે રહેવાય તો દર્શન સ્પર્શનાટિક
સર્વ પ્રકારનું તેમના સંબંધનું સુઅ અષ્ટપ્રદર ભળતું રહે તોજ હું
અહભાગી કહેવાઓ.

(સંપૂર્ણ.)

હિલગનું કીર્તન.

(રાગ—આશાવરી.)

મેરો માઈ હરિ નાગરસોં નેહ;
જથુતેં દસ્તિ પરે મન મોહન તથતેં ધિસ્યો ગેહ. ૧

કોઉ નિંદો કોઉ વંદો મો મન ગયો સહેહ,
સરિતા સિંધુ મિલી ધરમાનંહ લયો એક દસ તેહ. ૨

(મેરો માઈ હરિનાગરસોં નેહ) અર્થ એક વજલક્તા કહે છે
જે હે માઈ મારો તો હરિનાગર એવા પ્રભુની સાથે સ્નેહ છે, કારણ
કે સનહે કરવા લાયક પ્રભુજ છે કારણ કે રનેહને જણુનાર કે
નિલાવનાર પ્રભુજ છે, તે કિં પંચામૃતમાં કહેવ છે કે (રાગ

હુંદ્યો કોઇ ના ભિલ્યો નિલે અંતર્દીં પ્રીત, લોલી ચામ એર દામકે
કહા જને રસ રીતી)

અર્થ——જગતમાં પોજના કરતાં અંત સુધી પ્રીતને નિભાવે
તેવા કોઈ ન મળ્યો. કારણું કે સંસારીજનોનું સ્નેહ રવારથવાનું દામ
અને ચામના લોલવાનું છે તો તેવો પ્રભુ સંખ્યાની સ્નેહને
શું નાણી શરૂ મારે પ્રભુ સંખ્યાની સ્નેહ છે તેજ રસઃપ સર્વોપર
પદાર્થ છે. તેવી એ વરસક્તા કહે છે ને હરિ તાગર એવા પ્રક્રિ
સાથે મેં સ્નેહ કર્યો અને પ્રભુ સાથેનું સ્નેહ ઉંધી સર્વોપર વન્તુ છે
કે તે થતાની સાથ કેની ઉત્તમ દ્વારા થઈ જય છે તે એ પ્રથમ
ચરણના ઉત્તરાદ્ધિમાં વર્ણન કરે છે કે (જ્યાતે દાષ્ટિ પરે મનમોહન
તથતે અભિયોં ગેડ).

અર્થ—પ્રભુ કેવા છે તે પ્રથમ કહે છે ને એકાદશી ધૂદ્રિયનો
મન રાજ છે તેને પણું પ્રથમ આપ મોહી કેનારા છે એને જ્યારે
મન જય તો મનની સાથે સર્વ ધૂદ્રિયો પણું આપમાં જય છે તો
તે કાર્યને સૂચવનાં આપનું નામ મનમોહન અને કહેલ છે. તો
એવા મનમોહન જ્યારથી દાષ્ટિ પહ્યા ત્યારથી ગૃહાદિક (અભિયોં)
એટલે વિસમરણ થઈ ગયું. અર્થાત તેનું સુરણુજ ન રહ્યું. સુરણુ
તો જેમની સાથે સ્નેહ કર્યો છે તેનુંજ હોવું જોઈએ. તે પણું કે
રીતે કે ગૃહાદિક ને પ્રપંચ રૂપ છે તેની તો કિસ્મતીજ ઉચિત છે.
તે આ વરસક્તા પણું કહે છે જ્યારથી દાષ્ટિએ કરીને પ્રભુને મેં
દીકા ત્યારથી ગૃહાદિક પ્રપંચનું વિસમરણ થઈ ગયું અને આપમાં
સ્નેહ થયો એ બને અપૂર્વ લાલ ભને થયા અથવા એવી ઉત્તો-
જનમદ્શા ભને પ્રાત થઈ હવે એ કીર્તનના ધીજન ચરણના પુર્વધ્રમાં

કહે છે કે (કાઉ નીદો કોઉ વંદો મો મન ગયો સંદેહ) અર્થ—
પ્રભુ સંખ્યાધમાં કોઈ શ્થળે પણ સંદેહ યુક્ત ન રહેવું કારણ કે
અંધાદિકને વિષે આપે કહેલ છે કે (સંશ્યાત્માવિનસ્યતિ) સંશ્ય
યુક્ત જેની આત્મા છે તે નાસ પામે છે માટે ભગવદ્સંખ્યમાં
સંશ્ય કોઈ હેકાણે ન કરવો. નિઃસંદેહ રહેવું જ્યાં ચુંધી માણુસ
સંદેહ અથવા સંશ્યયુક્તા છે ત્યાં ચુંધી તેને નિંદા સ્તુતિની પરવા
રહે છે પણ જેના મનનો સંદેહ નિષ્ટત થઈ જય અને જે સંદેહથી
રહી નિઃસંદેહ થઈ જય છે તેને નિંદા સ્તુતિની કાંઈ પરવા રહેતી
નથી, તેથીજ આ ઉપકા ચરણમાં કહ્યું છે જે મારા મનનો સંદેહ
ગયો એટસે નિષ્ટત થઈ ગયો. હવે મારી કોઈ નિંદા કરો અથવા
સ્તુતિ કરો ગમે તે કરો તેની મને દરકાર નથી.

હવે જે કીર્તના બીજ ચરણના ઉત્તરાદ્ધર્થી પરમાનંદ
દાસજી એ કીર્તનાની સમાપ્તિ કરે છે જે (સરિતા સિંહુ માલી—
પરમાનંદ બયો એક રસ તેદ.)

અર્થ:—સરિતાં કહેતાં નદિનો પ્રવાહ દ્વારેશાં પોતાના પતિ
એવા સાગર તરફન વહ્ના કરે છે અને જણુને તેના રસમાં મળી જય
છે તેમ આપણો પ્રેમનો પ્રવાહ પણ નિર્જર વહીને પ્રભુમાં મળી
જવા જોઈએ એવી રીતે આ કીર્તના કરતા પરમાનંદદાસજી કહે
છે તો આ તેકાણે સરિતા સિંહુનું દણ્ઠાંત કેમ દીધું છે એમ જણવાની
ઘણી થાય તો જણવાનું કે પ્રભુ છે તે અન્નૈકિક સિંહુ અથવા
સાગર ઇપ છે અને ગોપીજન પ્રેમની નહી ઇપ છે એવી ઉપમા રાસ
પંચાધ્યાયીમાં નંદદાસજીએ આપેલી છે તે વિષે રાસ પંચાધ્યાયીમાં
નંદદાસજીએ કહેલ છે—

(આથ ઉમંગભોં મિલિ રંગિલી જોપ વહું અસ ॥ નંદ સુવન
 સુંદર સાગર સોં પ્રેમ નદી જસ) અર્થ રંગિલી એવી ગોપીજનો
 ઉમંગથી આવીને પ્રકૃતે એવી રીતે ભળો કે નંદરાયણના પુત્ર ૩૫
 સુંદર સાગરની સાથે પ્રેમની નદી ભળે તેમ ભળો તો આ કીર્તનની
 સમાધિમાં તેજ અલિપ્રાય લખેલો છે કે (સરિતા સિંહ મિલી
 પરનંદ લયો એક રસ તેણ) એટલે સરિતા જ્ઞાગરમાં ભળીને તેના
 રસમા એક રસ થઈ જથ્ય તેમ આ લક્ષ્ણ કહે છે કે મારો સ્નેહ પ્રકૃતમાં
 જઈ મળીને એક રસ થઈ ગયો છે.

